

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ

માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૪ ની

કલમ -૪ (૧) અન્વયે

પ્રો-એક્ટીવ ડિસ્કલોગર

અનુક્રમણિકા

ક્રમ નંબર	પ્રકરણ નંબર	પ્રકરણની વિગત	પાના નંબર
૧	૧	સંગઠનની વિગતો, વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો	૩
૨	૨	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો	૪
૩	૩	નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય પદ્ધતિ	૨૪
૪	૪,૫	કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો તથા કાર્યો બજાવવા માટેના નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહ, દફતરો	૨૫
૫	૬	સંગઠનના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોના વર્ગોનું પત્રક	૨૫
૬	૭	નીતિ ધડતર અથવા નીતિ અમલ સંબંધમાં જનતાના સભ્યો સાથે પરામર્શ	૨૫
૭	૮	વ્યવસ્થા તંત્રના ભાગ તરીકે અથવા સલાહના હેતુ માટે બે કે તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ કે સમિતિની નોંધ બાબત.	૨૫
૮	૯,૧૦	અધિકારી અને કર્મચારીઓની મા હિતી પુસ્તકા અને તેમને વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે મળતું મા સિક વળતર	૨૬
૯	૧૧	વ્યવસ્થાતંત્રને ફાળવેલ અંદાજપત્ર	૨૮
૧૦	૧૨,૧૩	આ ર્થિક સ હાય બાબત, આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો	૩૦
૧૧	૧૪	ઇલેક્ટ્રોનીક સ્વરૂપે મા હિતી	૩૧
૧૨	૧૫	ગ્રંથાલય, વાંચનાલય	૩૧
૧૩	૧૬	જાહેર મા હિતી અધિકારીઓના નામ, હોદ્દો, સરનામા, ફોન નંબર	૩૧
૧૪	૧૭	મા હિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો.	૩૧

પ્રકરણ-૧

સંગઠનની વિગતો, વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો

અમદાવાદ મુનિસીપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ આગ, પુર, વાવાંગોડુ - કોમી રમભાણો જેવી કુદરતી તેમજ માનવસર્જત આપત્તિઓના સમયે બચાવ કામગીરી માટે ફરજ બજાવે છે. આ ઉપરાંત ફાયરબ્રિગેડ ખાતા દ્વારા વી.આઈ.પી. બંદોબસ્ત, મ્યુનિ.બોર્ડ તેમજ સ્ટે. ક.માં બંદોબસ્ત તેમજ મ્યુનિ. કોર્પો.ના અન્ય અધિકારીઓના બંદોબસ્તની જવાબદારી ઉઠાવે છે. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ખાતુ ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ ચાલે છે. રાજ્ય સરકારશ્રીના જાહેરનામા અનુસાર અમદાવાદનો વિસ્તાર ૪૬૬ ચો. કિલોમીટર થયેલ છે. અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ અમદાવાદ શહેર ઉપરાંત નજીકના ગામો તથા શહેરોને જરૂર પડે ત્યારે અમદાવાદ ફાયર સર્વિસની મદદ આપે છે. તથા ગુજરાત રાજ્યભરમાં જે તે જગ્યા પર જરૂર પડે ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પો.નું ફાયર ખાતુ પુરા ગુજરાત ભરમાં રેસ્ક્યુ કોલોની સેવા પુરી પાડે છે.

અમદાવાદ શહેરમાં હાલમાં કુલ - ૧૪ ફાયર સ્ટેશનો કાર્યરત છે.

અ.નં.	ફાયર સ્ટેશનનું નામ	ટેલીફોન નંબર
૧	દાખાપીઠ ફાયર સ્ટેશન (હેડ કવાટ્સે) ફાયર કન્ટ્રોલ	૨૨૧૪૮૪૬૫ તથા ૨૨૧૪૧૭૬૫ ૨૮૨૮૮૩૨૫૭, ૧૦૧ તથા ૧૦૨
૨	જમાલપુર ફાયર સ્ટેશન	૨૫૩૮૭૯૮૫૮
૩	માણીનગર ફાયર સ્ટેશન	૨૫૪૭૦૨૨૧
૪	ગોમતીપુર ફાયર સ્ટેશન	૨૨૭૭૬૮૮૬
૫	નરોડા ફાયર સ્ટેશન	૨૨૨૦૦૭૧૭
૬	પાંચકુવા ફાયર સ્ટેશન	૨૨૧૨૦૩૮૮
૭	શાહપુર ફાયર સ્ટેશન	૨૫૬૨૧૮૬૬
૮	સાબરમતી ફાયર સ્ટેશન	૨૭૫૦૭૩૦૨
૯	મેમનગર ફાયર સ્ટેશન	૨૭૮૧૦૨૦૩
૧૦	ઓઢવ ફાયર સ્ટેશન	૨૨૮૭૫૪૩૪
૧૧	બોડકદેવ ફાયર સ્ટેશન	૨૮૦૮૭૭૩૬
૧૨	જશોદનગર ફાયર સ્ટેશન	૨૮૦૮૭૭૪૦
૧૩	અસલાલી ફાયર સ્ટેશન	૨૮૦૮૭૭૪૧
૧૪	થલતેજ ફાયર સ્ટેશન	-----

પ્રકરણ- ૨

અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

ચીફ ફાયર ઓફિસર :-

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ફાયર અને રેસ્ક્યુનાં તમામ પ્રકારનાં બનાવોમાં ઓપરેશનલ તેમજ ખાતાનાં વહીવટી વડા તરીકેનો ચાર્જ ચીફ ફાયરઓફિસરે સંભાળવાનો રહેશે.

ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો હવાલો સંભાળતા સંબંધિત જે તે ડે.ભૂનિ. કમિશનરની દેખરેખ ડેઠણ તેમજ મ્યુ. કમિશનરશ્રી જે ખાતાકીય ફરજ તેમજ જવાબદારી સોએ તે ફરજ તેમજ જવાબદારી નિભાવવાની રહેશે.

૧. ચીફ ફાયર ઓફિસરે મ્યુનિ. કોર્પો. દ્વારા નિયત કરેલ યુનિફોમ ઓફીસ તેમજ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે.
૨. ચીફ ફાયર ઓફિસરે ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવો દરમ્યાન જરૂર જણાયતો સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી હાથ નીચેનાં અધિકારી કર્મચારીઓને સફળતા પૂર્વકની કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.
૩. ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ફાયર અને રેસ્ક્યુનાં બનાવો તથા અન્ય ઈમરજન્સીનાં બનાવો તેમજ ખાતાકીય અન્ય મહત્વની કાર્યવાહીની નોંધ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ખાતાનો હવાલો સંભાળતા સંબંધિત ડે. મ્યુનિ. કમિશનરશ્રી / મ્યુનિ. કમિશનરશ્રીને લેખીતમાં કે મૌખિકમાં જાણ કરવાની રહેશે તથા આ અંગે ડે. મ્યુનિ. કમિશનરશ્રી કે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા જે તે બાબતની નોંધની જાણ ઉપરી સક્ષમ સત્તાને જણાવવાનું કહેવામાં આવે તો જે તે સક્ષમ સત્તાને પણ સંબંધિત બનાવ કે ઘટનાની કે કરવામાં આવેલ કાર્યવાહીની જાણ કરવાની રહેશે.
૪. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ફાયર એન્ડ રેસ્ક્યુની ઓપરેશનલ ફરજો ઉપરાંત, મ્યુનિ.કોર્પો.ના અન્ય ખાતાઓ, બહારની અન્ય સંસ્થાઓ, અન્ય મ્યુનિ.કોર્પો., અન્ય સરકારી - અર્ધ સરકારી સંસ્થા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે જરૂરી પત્રવ્યવહાર કરવાનો રહેશે.
૫. ચીફ ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્ષેત્રનાં વિસ્તારમાં તમામ પ્રકારનાં જરૂરી ઓધ્યોગિક એકમો / વિવિધ પ્રકારનાં ધંધાકીય એકમો / જાહેર - ખાનગી સંસ્થાઓ, સાહસોની જગ્યાઓ / ટેમ્પરરી સ્ટ્રક્ચર / હાઈરાઇઝ બિલ્ડિંગ / પબ્લિકગેધરિંગ લ્યેસેસ / સિનેમા - થિયેટર, ઓડિટોરીયમ, હોલ, પ્રદર્શન, મેળા, સરકસ તેમજ અન્ય જરૂરી તમામ જગ્યા ઉપર આગ - અક્સમાતની સલામતી બાબતે મ્યુનિ. કોર્પો.નાં નિતિ નિયમ અનુસાર જરૂરી નો - ઓબજેક્શન સર્ટીફિકેટ / અભિપ્રાય આપવાની કાર્યવાહી કરવા - કરાવવાની રહેશે. તેમજ આ અંગે વખતો વખત કે જરૂર પડે ત્યારે સક્ષમ સત્તા સાથે જરૂરી ચર્ચા - વિચારણા કરી આ અંગેની નિતિઓ નક્કી કરવા માટેની કાર્યવાહી કરવાની રહેશે.

૬. ચીફ ફાયર ઓફિસરે મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારની અંદર અને હદ બહારનાં આસપાસનાં વિસ્તારોમાં રહેલ આગ-અક્સમાતનાં તથા અન્ય હોનારતની શક્યતાઓને ધ્યાનમાં રાખી રહેલા જોખમોને પહોંચી વળવા સલામતીનાં ભાગ રૂપે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં જરૂરી તમામ પ્રકારનાં વાહનો, સાધનોનું વિસ્તૃતી કરણ, વહીવટી તંત્ર તથા અન્ય માળખાગત જરૂરીયાતોની વ્યવસ્થા કરવી અને ભવિષ્યમાં વખતો વખત વધતા જતાં જોખમોને ધ્યાનમાં રાખી તમામ આક્સિમિક પરિસ્થિતાઓમાં પહોંચી વળવા માટેનું સમય સર આયોજન કરી તેનો અમલ કરાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
૭. ચીફ ફાયર ઓફિસરે પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં તેમજ ઉપરી સક્ષમ સત્તા દ્વારા જણવવામાં આવે તે જગ્યાએ જાહેર સલામતીનાં હિતમાં જરૂર પડે ત્યારે ફાયર પ્રીવેન્શન - પ્રોટેક્શન માટે જરૂરી બંદોબસ્ત કરવાની વ્યવસ્થા કરાવવાની રહેશે.
૮. ચીફ ફાયર ઓફિસરનાં હોદ્દા જોગ મળેલ નાંણાકીય સત્તાની મર્યાદામાં ખાતાને લગતી જરૂરી તમામ સાધન સામગ્રી નિતી નિયમ અનુસાર ખરીદ કરવાની રહેશે.
૯. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ખાતાકીય તમામ પ્રકારની ફરિયાદોનો નિકાલ કરવાનો રહેશે.
૧૦. ચીફ ફાયર ઓફિસરે, ડીવીઝનલ ફાયર ઓફિસર અને તેનાથી નીચેના તમામ હોદ્દાનાં અધિકારી / કર્મચારીઓની પોતાની ફરજ ગ્રત્યે કે અન્ય અધિકારી - કર્મચારી સાથેની ફરજ ગ્રત્યેની બેદરકારી, ગેરશિસ્ત, ગેરવતર્ષૂક અથવા ફરજ ગ્રત્યેની ઉપેક્ષા જણાય તો જે તે સંબંધિત કર્મચારીને મ્યુનિસિપલ કોર્પોરેશનના નીતી - નિયમ અનુસાર પોતાની સત્તા મર્યાદામાં રહી જરૂરી શો - કોઝ નોટીસ / જાવક આપી જરૂરી ખુલાસો માંગવાની કાર્યવાહી તેમજ જરૂર પડે તે સંજોગોમાં જે તે હોદ્દાનાં સંબંધિત કર્મચારીને પોતાની ફરજ ગ્રત્યેની બેદરકારી કે ગેરશિસ્ત બદલ જરૂરી લેખીત કે મૌખિકમાં તાકીદ કરવાની કાર્યવાહી તેમજ શિક્ષાત્મક પગલા રૂપે જરૂરી ગાઈ ડ્યુટી આપવાની કાર્યવાહી કરવાની રહેશે અને કરેલ કાર્યવાહીની જાણ પોતાનાં ઉપરી અધિકારીને કરવાની રહેશે.
૧૧. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ખાતાકીય વહીવટ માટે તેયાર કરવામાં આવતા તમામ રજીસ્ટરો, દસ્તાવેજોનું અવાર નવાર કે આક્સ્મીક ચેકિંગ કરવાનું રહેશે. તથા ફાયર સેટેશનોની અચાનક મુલાકાત લઈ કરવામાં આવતી કામગીરીની દેખરેખ રાખવા જેવી તેમજ અન્ય વહીવટી ફરજી બજાવવાની રહેશે.
૧૨. ચીફ ફાયર ઓફિસરે પરેડ તથા ફાયર એન્ડ રેસ્ક્યુ ટ્રીલાનું આક્સ્મીક ઈન્સ્પેક્શન કરવાનું રહેશે.
૧૩. ચીફ ફાયર ઓફિસરે પોતાના સંબંધિત ડે. મ્યુનિ. કમિશનરશ્રીની પૂર્વ મંજૂરી મેળવીને જ જે તે પ્રકારની રજા ઉપર છૂટા થવાનું રહેશે અને પોતાની રજા ઉપરનાં સમય દરમ્યાન ખાતાકીય ચાર્જ તરજ પાછળનાં હાથ નીચેના કયા અધિકારીને સોંપીને જશે તે અંગેની જાણ કરવાની / મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે. ચીફ ફાયર ઓફિસર પોતાના સંબંધિત ડે. મ્યુનિ. કમિશનરશ્રી અથવા સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી સિવાય ફરજમાંથી મુક્ત થઈ શકશે નહિ.
૧૪. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ હસ્તનાં ટ્રેનિંગ સેન્ટરમાં ખાતાનાં કર્મચારીઓ તેમજ અન્ય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ માટે, તમામ પ્રકારનાં ઓઘોગિક એકમોનાં કર્મચારીઓ માટે, શાળા - કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે તથા અન્ય જરૂરી તમામ સંસ્થાઓનાં કર્મચારીઓ કે રહીશો માટે ફાયર એન્ડ સેફ્ટીને લગતી અવેરનેશ પ્રોગ્રામ તેમજ ફાયર એન્ડ રેસ્ક્યુની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગનું આયોજન કરાવી જરૂરી સંસ્થાઓ સાથે સંકલન કરવાનું રહેશે.

એડીશનલ ચીફ ફાયર ઓફિસર :-

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝમાં ફાયર અને રેસ્ક્યુનાં તમામ પ્રકારનાં બનાવોમાં ઓપરેશનલ ટેમ્જ ખાતાનાં બીજા કમનાં વહીવટી વડા તરીકેનો ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસરે સંભાળવાનો રહેશે.

એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ચીફ ફાયર ઓફિસરની સાથે રહીને અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝનો હવાલો સંભાળતા સંબંધિત જે તે ૩.મ્યુનિ. કમિશનરની દેખરેખ હેઠળ ટેમ્જ મ્યુનિ. કમિશનરશ્રી જે ખાતાકીય ફરજ ટેમ્જ જવાબદારી સોંપે તે ફરજ ટેમ્જ જવાબદારી નિભાવવાની રહેશે.

એડીશનલ ચીફ ફાયર ઓફિસરે મ્યુનિ. કોર્પો. દ્વારા નિયત કરેલ યુનિફોમ ઓફિસ ટેમ્જ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે.

૧. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ રેસ્ક્યુનાં ટેમ્જ અન્ય ઇમરજન્સીનાં બનાવો દરમ્યાન જરૂર જણાયતો સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી હાથ નીચેનાં અધિકારી કર્મચારીઓને સફળતા પૂર્વકની કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.
૨. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝમાં ફાયર અને રેસ્ક્યુનાં બનાવો તથા અન્ય ઇમરજન્સીનાં બનાવો ટેમ્જ ખાતાકીય અન્ય મહત્વની કાર્યવાહીની નોંધ ચીફ ફાયર ઓફિસરની ગેરહાજરીમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ખાતાનો હવાલો સંભાળતા સંબંધિત ૩. મ્યુનિ. કમિશનરશ્રી / મ્યુનિ. કમિશનરશ્રીને લેખીતમાં કૌબિકમાં જાણ કરવાની રહેશે તથા આ અંગે ૩. મ્યુનિ. કમિશનરશ્રી કે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા જે તે બાબતની નોંધની જાણ ઉપરી સક્ષમ સત્તાને જણાવવાનું કહેવામાં આવે તો જે તે સક્ષમ સત્તાને પણ સબંધિત બનાવ કે ઘટનાની કે કરવામાં આવેલ કાર્યવાહીની જાણ કરવાની રહેશે.
૩. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝમાં ફાયર એન્ડ રેસ્ક્યુની ઓપરેશનલ ફરજી ઉપરાંત, મ્યુનિ.કોર્પો.ના અન્ય ખાતાઓ, બહારની અન્ય સંસ્થાઓ, અન્ય મ્યુનિ.કોર્પો., અન્ય સરકારી - અર્ધ સરકારી સંસ્થા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે ચીફ ફાયર ઓફિસર ટેમ્જ સક્ષમ સત્તાની સુચના અનુસાર જરૂરી પત્રવ્યવહાર કરવાનો રહેશે.
૪. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્રૈતનાં વિસ્તારમાં તમામ પ્રકારનાં જરૂરી ઓદ્યોગિક એકમો / વિવિધ પ્રકારનાં ધંધાકીય એકમો / જાહેર - ખાનગી સંસ્થાઓ, સાહસોની જગ્યાઓ / ટેમ્પરરી સ્ટ્રોકચર / હાઈરાઇઝ બિલ્ડિંગ / પબ્લિક ગેધરીંગ પ્લેસીસ / સિનેમા - થિયેટર, ઓડીટોરીયમ, હોલ ટેમ્જ અન્ય જરૂરી તમામ જગ્યા ઉપર આગ - અક્સમાતની સલામતી બાબતે મ્યુનિ. કોર્પો.નાં નિતિ નિયમ અનુસાર જરૂરી નો - ઓબજેક્શન સટીફીકેટ / અભિપ્રાય આપવાની કાર્યવાહી ચીફ ફાયર ઓફિસર ટેમ્જ સક્ષમ સત્તાની સુચના અનુસાર કરવા - કરાવવાની રહેશે. ટેમ્જ આ અંગે વખતો વખત કે જરૂર પડે ત્યારે સક્ષમ સત્તા સાથે જરૂરી ચર્ચા - વિચારણા કરી આ અંગેની નિતિઓ નક્કી કરવા માટેની કાર્યવાહી કરવાની રહેશે.
૫. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારની અંદર અને હદ બહારનાં આસપાસનાં વિસ્તારોમાં રહેલ આગ-અક્સમાતનાં તથા અન્ય હોનારતની શક્યતાઓને ધ્યાનમાં રાખી રહેલા જોખમોને પહોંચી વળવા સલામતીનાં ભાગ રૂપે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝમાં જરૂરી

- તમામ પ્રકારનાં વાહનો, સાધનોનું વિસ્તૃતી કરણ, વહીવટી તંત્ર તથા અન્ય માળખાગત જરૂરીયાતોની વ્યવસ્થા કરવી અને ભવિષ્યમાં વખતો વખત વધતા જતાં જોખમોને ધ્યાનમાં રાખી તમામ આકસ્મિક પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટેનું સમય સર આયોજન કરી તેનો અમલ કરાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
૬. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ચીફ ફાયર ઓફિસર સાથે રહીને પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં તેમજ ઉપરી સક્ષમ સત્તા દ્વારા જણાવવામાં આવે તે જગ્યાએ જાહેર સલામતીનાં હિતમાં જરૂર પડે ત્યારે ફાયર પ્રીવેન્શન - પ્રોટેક્શન માટે જરૂરી બંદોબસ્ત કરવાની વ્યવસ્થા કરાવવાની રહેશે.
 ૭. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે, ડીવીઝનલ ફાયર ઓફિસર અને તેનાથી નીચેના તમામ હોદાનાં અધિકારી / કર્મચારીઓની પોતાની ફરજ પ્રત્યે કે અન્ય અધિકારી - કર્મચારી સાથેની ફરજ પ્રત્યેની બેદરકારી, ગેરશિસ્ત, ગેરવતર્ણુક અથવા ફરજ પ્રત્યેની ઉપેક્ષા જણાય તો જે તે સંબંધિત કર્મચારીને ખુનિસિપલ કોર્પોરેશનના નીતી - નિયમ અનુસાર પોતાની સત્તા મર્યાદામાં રહી જરૂરી શો - કોઝ નોટીસ / જવક આપી જરૂરી ખુલાસો માંગવાની કાર્યવાહી તેમજ જરૂર પડે તે સંજોગોમાં જે તે હોદાનાં સંબંધિત કર્મચારીને પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી કે ગેરશિસ્ત બદલ જરૂરી લેખીત કે મૌખિકમાં તાકીદ કરવાની કાર્યવાહી તેમજ શિક્ષાત્મક પગલા રૂપે જરૂરી ગાઈ ડ્યુટી આપવાની કાર્યવાહી કરવાની રહેશે અને કરેલ કાર્યવાહીની જાણ પોતાનાં ઉપરી અધિકારીને કરવાની રહેશે.
 ૮. એડીશનલ ચીફ ફાયર ઓફિસરનાં હોદા જોગ મળેલ નાંખાકીય સત્તાની મર્યાદામાં ખાતાને લગતી જરૂરી તમામ સાધન સામગ્રી નિતિ નિયમ અનુસાર ખરીદ કરવાની રહેશે.
 ૯. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ચીફ ફાયર ઓફિસરની સાથે રહીને ખાતાકીય તમામ પ્રકારની ફરિયાદોનો નિકાલ કરવાનો રહેશે.
 ૧૦. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ખાતાકીય વહીવટ માટે તૈયાર કરવામાં આવતા તમામ રજીસ્ટરો, દસ્તાવેજોનું અવાર નવાર કે આકસ્મીક ચેકિંગ કરવાનું રહેશે. તથા ફાયર સ્ટેશનોની અચાનક મુલાકાત લઈ કરવામાં આવતી કામગીરીની દેખરેખ રાખવા જેવી તેમજ સક્ષમ સત્તાની સુચના અનુસાર અન્ય વહીવટી ફરજો બજાવવાની રહેશે.
 ૧૧. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ડીવીઝનલ ફાયર ઓફિસરનાં હોદા સુધીનાં તમામ કર્મચારીઓની પોતાની સત્તા મર્યાદામાં રહીને, કેઝ્યુઅલ રજા, હક્ક રજા, માંદગીની રજા, જાહેર તહેવારની રજા નિતિ નિયમ અનુસાર મંજૂર કરવાની રહેશે. આ રજાઓ મંજૂર કરતી વખતે ખાતાકીય કામગીરી જડપી અને સરળતાથી કરી શકાય તે માટે જરૂરી સ્ટાફની હાજરીને ધ્યાનમાં રાખી રજા મંજૂર કરવાની રહેશે.
 ૧૨. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે પરેડ તથા ફાયર એન્ડ રેસ્ક્યુ સ્રીલનું આકસ્મીક ઈન્સપેક્શન કરવાનું રહેશે.
 ૧૩. એડીશનલ ચીફ ફાયર ઓફિસર સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ જે તે પ્રકારની રજા ઉપર છૂટા થવાનું રહેશે અને પોતાની રજા ઉપરનાં સમય દરમાન ખાતાકીય ચાર્જ તરજ પાછળનાં હાથ નીચેના કયા અધિકારીને સોંપીને જશે તે અંગેની જાણ કરવાની / મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે. એડીશનલ ચીફ ફાયર ઓફિસર પોતાના સંબંધિત ડેભ્યુનિ કમિશનરશી અથવા સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી સિવાય ફરજમાંથી મુક્ત થઈ શકશે નહિ.
 ૧૪. એડીશનલ ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ હસ્તાનાં ટ્રેનિંગ સેન્ટરમાં ખાતાનાં કર્મચારીઓ તેમજ અન્ય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ માટે, તમામ પ્રકારનાં ઓધોગિક એકમોનાં

કર્મચારીઓ માટે, શાળા - કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે તથા અન્ય જરૂરી તમામ સંસ્થાઓનાં કર્મચારીઓ કે રહીશો માટે ફાયર એન્ડ સેફ્ટીને લગતા અવેરનેશ પ્રોગ્રામ તેમજ ફાયર એન્ડ રેસ્ક્યુની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગનું આપોજન કરાવી જરૂરી સંસ્થાઓ સાથે જરૂર પડે ત્યારે સક્ષમ સત્તાની સુચના અનુસાર સંકલન કરવાનું રહેશે.

ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસર :-

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસર ખાતાનાં વડા (ચીફ ફાયર ઓફિસર / એડીશનલ ચીફ ફાયર ઓફિસર) ની સીધી દેખરેખ હેઠળ ફરજ બજાવવાની રહેશે.

ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસર મ્યુનિ. કોર્પો. દ્વારા નિયત કરેલ યુનિફોમ ઓફિસ તેમજ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે.

1. ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્ષેત્રના વિસ્તારમાં ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવો દરમ્યાન સ્થળ ઉપર ઢુબરુ હાજર રહી હાથ નીચેનાં અધિકારી કર્મચારીઓને સફળતા પૂર્વકની કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.
2. ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ફાયર અને રેસ્ક્યુનાં બનાવો તથા અન્ય ઈમરજન્સીનાં બનાવો તેમજ ખાતાકીય અન્ય મહત્વની કાર્યવાહીની નોંધની ચીફ ફાયર ઓફિસર / એડીશનલ ચીફ ફાયર ઓફિસરને લેખીતમાં કે મૌખિકમાં જરૂરીયાત મુજબ જાણ કરવાની રહેશે તથા ચીફ ફાયર ઓફિસર અને એડીશનલ ચીફ ફાયર ઓફિસરની ગેરહાજરી દરમ્યાન આ અંગે પોતાનાં સંબંધિત ડે. મ્યુનિ. કમિશનરશ્રીને સંબંધિત બનાવ કે ઘટનાની કરવામાં આવેલ કાર્યવાહીની જાણ કરવાની રહેશે.
3. ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ફાયર અને રેસ્ક્યુની ઓપરેશનલ ફરજો ઉપરાંત, પોતાનાં ખાતાકીય કામગીરીને લગતી તમામ બાબતોનો આતંરીક પત્ર વ્યવહાર (ઈન્ટરનલ રીપોર્ટિંગ) સક્ષમ સત્તા સાથે કરવાનો રહેશે.
4. ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્ષેત્રના વિસ્તારમાં તમામ પ્રકારનાં જરૂરી ઓફોનિક એકમો / વિવિધ પ્રકારનાં ધંધાકીય એકમો / જાહેર - ખાનગી સંસ્થાઓ - સાહસોની જગ્યાઓ / ટેમ્પરરી સ્ટ્રોક્ચર / હાઇરાઇઝ બિલ્ડીંગ / પબ્લીકેગેધરીંગ પ્લેસીસ / સિનેમા - થિયેટર, ઓડિટોરિયમ, હોલ તેમજ અન્ય જરૂરી તમામ જગ્યા ઉપર આગ - અક્સમાતની સલામતી બાબતે મ્યુનિ. કોર્પો.નાં નિતિ નિયમ અનુસાર જરૂરી નો - ઓબજેક્શન સર્ટીફીકેટ / અભિપ્રાય આપવાની કાર્યવાહી ચીફ ફાયર ઓફિસર તેમજ સક્ષમ સત્તાની સુચના અનુસાર કરવાની રહેશે. તેમજ આ અંગે વખતો વખત કે જરૂર પડે ત્યારે સક્ષમ સત્તા સાથે જરૂરી ચર્ચા - વિચારણા કરી આ અંગેની નિતિઓ નક્કી કરવા માટેની કાર્યવાહી કરવાની રહેશે.
5. ટેચ્યુટી ચીફ ફાયર ઓફિસરે પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં તેમજ ઉપરી સક્ષમ સત્તા દ્વારા જણાવવામાં આવે તે જગ્યાએ જાહેર સલામતીનાં હિતમાં જરૂર પડે ત્યારે ફાયર પ્રીવેન્શન - પ્રોટેક્શન માટે જરૂરી બંદોબસ્ત કરવાની વ્યવસ્થા કરાવવાની રહેશે તેમજ ઉપરી અધિકારીની

- સુચના અનુસાર જરૂર પડે ત્યારે બંદોબસ્તનાં સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી જરૂરી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
૬. તેઘુટી ચીફ ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્ષેત્ર વિસ્તારની ખાતાકીય તમામ પ્રકારની ફરિયાદોનો નિકાલ પોતાના ઉપરી અધિકારી કે સક્ષમ સત્તાની સુચના અનુસાર કરવાનો રહેશે.
 ૭. તેઘુટી ચીફ ફાયર ઓફિસરે પોતાના હાથ નીચેના તમામ હોદાનાં અધિકારી / કર્મચારીઓની પોતાની ફરજ પ્રત્યે કે અન્ય અધિકારી - કર્મચારી સાથેની ફરજ પ્રત્યેની બેદરકારી, ગેરશિસ્ત, ગેરવતાર્થીક અથવા ફરજ પ્રત્યેની ઉપેક્ષા જણાય તો જે તે સંબંધિત કર્મચારીને મુનિસિપલ કોર્પોરેશનના નીતિ - નિયમ અનુસાર પોતાની સત્તા મર્યાદામાં રહી જરૂરી શો - કોઝ નોટીસ / જાવક આપી જરૂરી ખુલાસો માંગવાની કાર્યવાહી તેમજ જરૂર પડે તે સંજોગોમાં જે તે હોદાનાં સંબંધિત કર્મચારીને પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી કે ગેરશિસ્ત બદલ જરૂરી લેખીત કે મૌખિકમાં તાકીદ કરવાની કાર્યવાહી તેમજ શિક્ષાત્મક પગલા રૂપે જરૂરી ગાઈ ડ્યુટી આપવાની કાર્યવાહી કરવાની રહેશે અને કરેલ કાર્યવાહીની જાણ પોતાનાં ઉપરી અધિકારીને કરવાની રહેશે.
 ૮. તેઘુટી ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ખાતાકીય વહીવટ માટે તૈયાર કરવામાં આવતા તમામ રજીસ્ટરો, દસ્તાવેજો પોતાના હાથ નીચેના સંબંધિત અધિકારી કર્મચારી પાસે તૈયાર કરાવી ખાતાકીય તમામ રજીસ્ટરો દસ્તાવેજોનું અવાર નવાર કે આક્સમીક ચેકીંગ કરવાનું રહેશે. તથા ફાયર સ્ટેશનોની અચાનક મુલાકાત લઈ કરવામાં આવતી કામગીરીની દેખરેખ રાખવા જેવી તેમજ સક્ષમ સત્તાની સુચના અનુસાર અન્ય વહીવટી ફરજી બજાવવાની રહેશે.
 ૯. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો સ્ટોર્સ તેઘુટી ચીફ ફાયર ઓફિસરની સીધી દેખરેખ હેઠળ રહેશે. આ અંગેના સ્ટોર્સમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ઉપયોગમાં આવતા જરૂરી સાધનો - વાહનો, તમામ પ્રકારનાં વાહનો માટેનાં ઓટોમોબાઇલને લગતા જરૂરી સ્પેર પાર્ટ્સ, યુનિફોર્મ, યુનિફોર્મ આર્ટિકલ, સ્ટેશનરી તેમજ જરૂરી અન્ય સર - સામાન, સાધનો, વાહનો વગેરે મુનિ. કોર્પો.ના નીતિ - નિયમ અનુસાર સક્ષમ સત્તા પાસેથી ખરીદ કરવાની કે કોર્પોરેશન સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મંગાવવાની તમામ વહીવટી કાર્યવાહી કરવાની રહેશે. આ અંગે સ્ટોર્સને લગતા તમામ સાધનો, વાહનોનાં સ્ટોક રજીસ્ટર, ટેડસ્ટોક રજીસ્ટર તથા અન્ય જરૂરી દરસ્તાવેજો પોતાની સીધી દેખરેખ હેઠળ હાથ નીચેનાં અધિકારી કર્મચારી પાસે સમય મર્યાદામાં તૈયાર કરવાનાં રહેશે.
 ૧૦. તેઘુટી ચીફ ફાયર ઓફિસરે સ્ટેશન ફાયર ઓફિસરનાં હોદા સુધીનાં તમામ કર્મચારીઓની પોતાની સત્તા મર્યાદામાં રહીને, કેઝ્યુઅલ રજા, હક્ક રજા, માંડગીની રજા, જાહેર તહેવારની રજા નિતિ નિયમ અનુસાર મંજૂર કરવાની રહેશે. આ રજાઓ મંજૂર કરતી વખતે ખાતાકીય કામગીરી ઝડપી અને સરળતાથી કરી શકાય તે માટે જરૂરી સ્ટાફની હાજરીને ધ્યાનમાં રાખી રજા મંજૂર કરવાની રહેશે.
 ૧૧. તેઘુટી ચીફ ફાયર ઓફિસરે પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ ફ્રીલમાં પોતાની ઉપરી સક્ષમ સત્તાની સુચના અનુસાર હાજર રહી પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ ફ્રીલનું અવાર - નવાર / આક્સમીક ઈન્સ્પેક્શન કરવાનું રહેશે.

૧૨. તેઘુટી ચીફ ફાયર ઓફિસર સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ જે તે પ્રકારની રજા ઉપર છૂટા થવાનું રહેશે. તેઘુટી ચીફ ફાયર ઓફિસર પોતાની સબંધિત સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી સિવાય ફરજમાંથી મુક્ત થઈ શકશે નહિ.
૧૩. તેઘુટી ચીફ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ હસ્તનાં ટ્રેનિંગ સેન્ટરમાં ખાતાનાં કર્મચારીઓ તેમજ અન્ય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ માટે, તમામ પ્રકારનાં ઓફોનિક એકમોનાં કર્મચારીઓ માટે, શાળા - કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે તથા અન્ય જરૂરી તમામ સંસ્થાઓનાં કર્મચારીઓ કે રહીશો માટે ફાયર એન્ડ સેફ્ટીને લગતા અવેરનેશ પ્રોગ્રામ તેમજ ફાયર એન્ડ રેસ્ક્યુની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગનું માસીક કાર્યક્રમનું આયોજન કરી તેમજ ખાતાનાં કર્મચારીઓ માટે પરેડનો માસિક કાર્યક્રમ તૈયાર કરી તેની નકલ એડી. ચીફ ફાયર ઓફિસર મારફતે ચીફ ફાયર ઓફિસર તેમજ સંબંધિત ડે. ભ્યુનિ. કમિશનર સાહેબને જાણ માટે રજુ કરવાની રહેશે.

ડીવીઝનલ ફાયર ઓફિસર :-

ડીવીઝનલ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા જે તે ફાયર સ્ટેશનનાં ડીવીઝનનાં વડા તરીકેની ફરજની સાથે-સાથે ખાતાનાં વડા ચીફ ફાયર ઓફિસર, એડીશનલ ચીફ ફાયર ઓફિસર, તેઘુટી ચીફ ફાયર ઓફિસર કે ઉપરી સક્ષમ સત્તાની સીધી દેખરેખ હેઠળ ફરજ બજાવવાની રહેશે.

1. ડીવીઝનલ ફાયર ઓફિસરે ભ્યુનિ. કોર્પો. દ્વારા નિયત કરેલ યુનિફોમ ઓફીસ તેમજ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે.
2. ડીવીઝનલ ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્ષેત્રના વિસ્તારમાં ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવો દરમ્યાન સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી, જરૂરી બચાવ કામગીરી કરવા ઉપરાંત, હાથ નીચેનાં અધિકારી કર્મચારીઓને સફળતા પૂર્વકની કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.
3. ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવોમાં સ્થળ ઉપર પહોંચવા માટે તેઓને ફાળવવામાં આવેલ ઓફિસર લીકલ કોર્પશ કારણોસર ઉપલબ્ધ નાં હોય તેવા સંજોગોમાં ઉપરી અધિકારીની સુચના મુજબ જે વાહન ફાળવવામાં આવે તેમાં જવાનું રહેશે.
4. દરેક ડીવીઝનલ ફાયર ઓફિસરે પોતાનાં ડીવીઝનનાં તમામ ફાયર સ્ટેશનના ફાયર અને રેસ્ક્યુનાં બનાવો તથા અન્ય ઈમરજન્સીનાં બનાવો તેમજ ડીવીઝનનું વહીવટી સંચાલન કરવાનું તથા અન્ય મહત્વની કાર્યવાહીની નોંધની જાણ તેઘુટી ચીફ ફાયર ઓફિસરશ્રી મારફતે એડીશનલ ચીફ ફાયર ઓફિસરને કરવાની રહેશે. અને જરૂરી સંજોગોમાં ચીફ ફાયર ઓફિસરને લેખીતમાં કે મૌખિકમાં જરૂરીયાત મુજબ જાણ કરવાની રહેશે.
5. ડીવીઝનલ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ફાયર અને રેસ્ક્યુની ઓપરેશનલ ફરજો ઉપરાંત, પોતાનાં ડીવીઝનની કામગીરીને લગતી તમામ બાબતોનો આતંરીક પત્ર વ્યવહાર (ઈન્ટરનલ રીપોર્ટિંગ) પોતાનાં ઉપરી અધિકારી કે સક્ષમ સત્તા સાથે કરવાનો રહેશે.

૫. ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્રોતનાં વિસ્તારમાં તમામ પ્રકારનાં જરૂરી ઓધોગિક એકમો / વિવિધ પ્રકારનાં ધંધાકીય એકમો / જાહેર - ખાનગી સંસ્થાઓ - સાહસોની જગ્યાઓ / ટેમ્પરરી સ્ટ્રક્ચર / હાઈરાઇઝ બિલ્ડીંગ / પબ્લીકગેધરીંગ લેસીસ / સિનેમા - થિયેટર, ઓડીટોરીયમ, હોલ તેમજ અન્ય જરૂરી તમામ જગ્યા ઉપર આગ - અક્સમાતની સલામતી બાબતે મુનિ. કોર્પો.નાં નિતિ નિયમ અનુસાર જરૂરી નો - ઓબજેક્શન સર્ટીફિકેટ / અભિપ્રાય આપવાની કાર્યવાહી ચીફ ફાયર ઓફિસર તેમજ સક્ષમ સત્તાની સુચના અનુસાર કરવાની રહેશે. તેમજ આ અંગે વખતો વખત કે જરૂર પડે ત્યારે સક્ષમ સત્તા સાથે જરૂરી ચર્ચા - વિચારણા કરી આ અંગેની નિતિઓ નક્કી કરવા માટે પોતાનો અભિપ્રાય આપવાનો રહેશે.
૬. ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાના કાર્યક્રોત વિસ્તારમાં ઉપરી સક્ષમ સત્તા દ્વારા જણાવવામાં આવે તે જગ્યાએ જાહેર સલામતીનાં હિતમાં જરૂર પડે ત્યારે ફાયર પ્રીવેન્શન - પ્રોટેક્શન માટે જરૂરી બંદોબસ્ત કરવાની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ ઉપરી અધિકારીની સુચના અનુસાર જરૂર પડે ત્યારે બંદોબસ્તનાં સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
૭. ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાનાં ડીવીજનનાં ફાયર સ્ટેશનોની તમામ પ્રકારની ફરિયાદોનો નિકાલ પોતાના ઉપરી અધિકારી કે સક્ષમ સત્તાની સુચના અનુસાર કરવાનો રહેશે.
૮. ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાના ડીવીજનનાં ફાયર સ્ટેશનોમાં ફરજ બજાવતા સ્ટેશન ફાયર ઓફિસરથી નીચેના તમામ હોદાનાં કર્મચારીઓની પોતાની ફરજ પ્રત્યે કે અન્ય અધિકારી - કર્મચારી સાથેની ફરજ પ્રત્યેની બેદરકારી, ગેરશિસ્ત, ગેરવતર્ષુક અથવા ફરજ પ્રત્યેની ઉપેક્ષા જણાય તો જે તે સંબંધિત કર્મચારીને મુનિસિપલ કોર્પોરેશનના નીતિ - નિયમ અનુસાર પોતાની સત્તા મર્યાદામાં રહી જરૂરી જાવક આપી જરૂરી ખુલાસો માંગવાની કાર્યવાહી તેમજ જરૂર પડે તે સંઝોગોમાં જે તે હોદાનાં સંબંધિત કર્મચારીને પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી કે ગેરશિસ્ત બદલ જરૂરી લેખીત કે મૌખીકમાં તાકીદ કરવાની કાર્યવાહી તેમજ શિક્ષાત્મક પગલા રૂપે સત્તા મર્યાદામાં જરૂરી ગાઈ ડયુટી આપવાની કાર્યવાહી કરવાની રહેશે અને કરેલ કાર્યવાહીની જાણ પોતાનાં ઉપરી અધિકારીને કરવાની રહેશે.
૯. ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાનાં ડીવીજનનાં ફાયર સ્ટેશનોનાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં ખાતાકીય વહીવટ માટે તૈયાર કરવામાં આવતા તમામ રજીસ્ટરો, દસ્તાવેજો પોતાના હાથ નીચેના સંબંધિત અધિકારી કર્મચારી પાસે નિયમિત ધોરણે સમય મર્યાદામાં તૈયાર કરાવી ખાતાકીય તમામ રજીસ્ટરો દસ્તાવેજોનું નિયમિત તેમજ આક્સમીક ચેકીંગ કરી જરૂરી દસ્તાવેજો, રજીસ્ટરો ઉપરી અધિકારીની સુચના અનુસાર નોંધ માટે મુકવાનાં રહેશે. તથા ફાયર સ્ટેશનોની અચાનક મુલાકાત લઈ કરવામાં આવતી કામગીરીની દેખરેખ રાખવા જેવી તેમજ સક્ષમ સત્તાની સુચના અનુસાર અન્ય વહીવટી ફરજો બજાવવાની રહેશે.
૧૦. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો સ્ટોર્સમાં રાખવામાં આવતા જરૂરી સાધનો - વાહનો, તમામ પ્રકારનાં વાહનો માટેનાં ઓટોમોબાઈલને લગતા જરૂરી સ્પેર પાર્ટ્સ, યુનિફોર્મ, યુનિફોર્મ આર્ટીકલ, સ્ટેશનરી તેમજ જરૂરી અન્ય સર - સામાન, સાધનો, વાહનો વગેરે મુનિ. કોર્પો.ના નિતી - નિયમ અનુસાર સક્ષમ સત્તા પાસેથી ખરીદ કરાવવાની કે કોર્પોરેશન સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મંગાવવાની તમામ વહીવટી કાર્યવાહી ઉપરી અધિકારીની સુચના મુજબ સ્ટોર્સનાં સંબંધિત કર્મચારી પાસે કરાવવાની રહેશે. આ અંગે સ્ટોર્સને લગતા તમામ સાધનો, વાહનોનાં સ્ટોક રજીસ્ટર, ડેસ્ટોક રજીસ્ટર તથા અન્ય જરૂરી

દરસ્તાવેજો પોતાની દેખરેખ હેઠળ હાથ નીચેનાં કર્મચારી પાસે સમય મર્યાદામાં તૈયાર કરવવાનાં રહેશે.

૧૧. ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાનાં ડીવીજનનાં ફાયર સ્ટેશનોનાં સ્ટેશન ફાયર ઓફિસરથી નીચેનાં હોકા સુધીનાં તમામ કર્મચારીઓની પોતાની સત્તા મર્યાદામાં રહીને, શૉર્ટલીવ (ટુકી રજા) ઉપરાંત કેઝ્યુઅલ રજા, હક્ક રજા, માંડગીની રજા, જહેર તહેવારની રજા નિતિ નિયમ અનુસાર મંજૂર કરવાની રહેશે. આ રજાઓ મંજૂર કરતી વખતે ખાતાકીય કામગીરી ઝડપી અને સરળતાથી કરી શકાય તે માટે જરૂરી સ્ટાફની હાજરીને ધ્યાનમાં રાખી ખાતાકીય સગવડતા મુજબ રજા મંજૂર કરવાની રહેશે.
૧૨. ડીવીજનલ ફાયર ઓફિસરે તમામ પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ શ્રીલમાં પોતાની ઉપરી સક્ષમ સત્તાની સુચના અનુસાર હાજર રહી પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ શ્રીલમને લગતી તમામ કાર્યવાહી હાથ નીચેનાં કર્મચારીઓને શીખવાડવાની સાથે-સાથે અવાર - નવાર પરેડ તથા શ્રીલમનું ઈન્સ્પેક્શન કરવાનું રહેશે.
૧૩. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનાં હાઈડ્રોલીક પ્લેટફોર્મ, કેઈન, ઈમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, ડી.સી.પી. ટેન્ડર, ફોમ ટેન્ડર, બી.એ. વાન તેમજ અન્ય વાહનો અને કિમંતી અને નાજૂક તમામ સાધનોનો (ઉપયોગ, મેઈન્ટેનાન્સ, રીપેરીંગ તથા અન્ય કાર્યવાહી) તમામ ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાની સીધી દેખરેખ હેઠળ કરવાની રહેશે. અને જરૂર પડે થી પોતાનાં ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવી તે મુજબની કામગીરી કરવાની રહેશે.
૧૪. ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાની ઉપરી સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ જે તે પ્રકારની રજા ઉપર છૂટા થવાનું રહેશે. અને તે બાબતની મંજૂરી મળેથી હેડ કવાટર ખાતે કંન્ટ્રોલરૂમને તે બાબતની જાણ કર્યા બાદ જ રજા ઉપર છૂટા થવાનું રહેશે. ડીવીજનલ ફાયર ઓફિસર પોતાની સબંધિત સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી સિવાય ફરજમાંથી મુક્ત થઈ શકશે નહિએ.
૧૫. દરેક ડીવીજનલ ફાયર ઓફિસરે પોતાનાં ડીવીજનનાં તમામ ફાયર સ્ટેશનોનાં આગ - અક્સમાતનાં તેમજ અન્ય ઈમરજન્સી બનાવો તેમજ અન્ય કામગીરીનો માસીક - ત્રિમાસીક - છ માસીક અને વાર્ષિક અહેવાલ સમય મર્યાદામાં તૈયાર કરી તેઘુટી ચીફ ફાયર ઓફિસર / એડિશનલ ચીફ ફાયર ઓફિસર મારફતે ચીફ ફાયર ઓફિસરને રજુ કરવાનો રહેશે. તેમજ ચીફ ફાયર ઓફિસરની સુચના અનુસાર હેડ કવાટર ખાતેનાં ડીવીજનલ ફાયર ઓફિસરે સમગ્ર ખાતાનો વાર્ષિક અહેવાલ સમય મર્યાદામાં તૈયાર કરવાનો રહેશે.
૧૬. ડીવીજનલ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ હસ્તકનાં ટ્રેનિંગ સેન્ટરમાં ખાતાનાં કર્મચારીઓ તેમજ અન્ય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ માટે, તમામ પ્રકારનાં ઓધ્યોગિક એકમોનાં કર્મચારીઓ માટે, શાળા - કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે તથા અન્ય જરૂરી તમામ સંસ્થાઓનાં કર્મચારીઓ કે રહીશો માટે ફાયર એન્ડ સેફ્ટીને લગતા અવેરનેશ ગ્રોગ્રામ તેમજ ફાયર એન્ડ રેસ્ક્યુની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપી તેમજ ખાતાનાં કર્મચારીઓ માટે પરેડનો માસિક કાર્યક્રમ તૈયાર કરી તેનો અમલ કરી કરાવીને તેની જરૂરી નોંધ તેઘુટી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર મારફતે ચીફ ફાયર ઓફિસરને કરવાની રહેશે.
૧૭. તમામ ડીવીજનલ ફાયર ઓફિસરોએ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનાં ચીફ ફાયર ઓફિસર કે તેમના દ્વારા જે ખાતાકીય ફરજ સોંપવામાં આવે તે ફરજ બજાવવાની રહેશે.

સ્ટેશન ફાયર ઓફિસર :-

સ્ટેશન ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં તેઓનું જે ફાયર સ્ટેશન ઉપર પોસ્ટીંગ કરવામાં આવેલ હોય તે ફાયર સ્ટેશન ઉપર જે તે ફાયર સ્ટેશનનાં સ્ટેશન ઈન્ચાર્જ તરીકે સ્ટેશન લેવલની ઓપરેશનલ ફરજો બજાવવાની સાથે - સાથે પોતાનાં ડીવીઝનલ ઓફિસર કે તેનાથી ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓનાં આદેશ મુજબ ખાતાકીય જે ફરજો સોંપવામાં આવે તે બજાવવાની રહેશે.

૧. સ્ટેશન ફાયર ઓફિસરે મ્યુનિ. કોર્પો. દ્વારા નિયત કરેલ યુનિફોમ ઓફીસ તેમજ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે અને નિયમિત હેરકટીંગ અને કલીન શેવીંગ સાથેના સ્માર્ટ ટર્નઆઉટમાં ફરજ ઉપર આવવાનું રહેશે, તેમજ પોતાનાં હાથ નીચેના કર્મચારીઓ પાસે સદર બાબતનું પાલન નિયમીત પણે કરાવવાનું રહેશે.
૨. સ્ટેશન ફાયર ઓફિસર ફાયર સ્ટેશન ઉપર હાજર હોય ત્યારે હાથ નીચેનાં કર્મચારીઓની ટૈનિક હાજરી લેવા માટે તેમજ વર્કિંગ / મેઈનન્ટેનન્સનાં સમયમાં પોતાનાં હાથ નીચેનાં કર્મચારીઓ પાસેથી જરૂરી કામગીરી કરાવવા માટેનું આયોજન કરવાનું રહેશે.
૩. સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્ષેત્રના વિસ્તારમાં ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવો દરમ્યાન સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી, જરૂરી બચાવ કામગીરી કરવા ઉપરાંત, હાથ નીચેનાં કર્મચારીઓને સફળતા પૂર્વકની કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે. ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવોમાં સ્થળ ઉપર પહોંચવા માટે તેઓને ફાળવવામાં આવેલ ઓફિસર વ્હીકલ કોઈપણ કારણોસર ઉપલબ્ધનાં હોય તેવા સંજોગોમાં ઉપરી અધિકારીની સુચના મુજબ જે વાહન ફાળવવામાં આવે તેમાં જવાનું રહેશે.
૪. દરેક સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં ચાર્જનાં ફાયર સ્ટેશનના ફાયર અને રેસ્ક્યુનાં બનાવોમાં તથા અન્ય ઈમરજન્સીનાં બનાવોમાં તેમજ સ્ટેશન લેવલનું વહીવટી સંચાલન કરવાનું તથા અન્ય મહત્વની કાર્યવાહીની નોંધની જાણ તેઓનાં ડીવીઝનલ નીચેનાં ડીવીઝનલ ફાયર ઓફિસર મારફતે જ પોતાની ઉપરી સક્ષમ સત્તાને કરવાની રહેશે. અને જરૂરી સંજોગોમાં ચીફ ફાયર ઓફિસરને લેખીતમાં કે મૌખિકમાં જરૂરીયાત મુજબ જાણ કરવાની રહેશે.
૫. સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં ચાર્જનાં ફાયર સ્ટેશનની, ફાયર અને રેસ્ક્યુની ઓપરેશનલ ફરજો ઉપરાંત, પોતાનાં સ્ટેશન લેવલની કામગીરીને લગતી તમામ બાબતોનો આતંરીક પત્ર વ્યવહાર (ઇન્ટરનલ રીપોર્ટિંગ) ડીવીઝનલ ફાયર ઓફિસર મારફતે સક્ષમ સત્તા સાથે કરવાનો રહેશે.
૬. સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં કાર્યક્ષેત્રનાં વિસ્તારમાં તમામ પ્રકારનાં જરૂરી ઓફ્ફિશિયલ એકમો / વિવિધ પ્રકારનાં ધંધાકીય એકમો / જાહેર - ખાનગી સંસ્થાઓ - સાહસોની જગ્યાઓ / ટેમ્પરરી સ્ટ્રક્ચર / હાઈરાઇઝ બિલ્ડિંગ / પબ્લિકગેધરીંગ પ્લેસીસ / સિનેમા - થિયેટર, ઓડિટોરીયમ, હોલ તેમજ અન્ય જરૂરી તમામ જગ્યા ઉપર આગ - અક્સમાતની સલામતી બાબતે મ્યુનિ. કોર્પો.નાં નિતિ નિયમ અનુસાર જરૂરી નો - ઓબજેક્શન સટીફીકેટ / અલિગ્રાય આપવાની કાર્યવાહી ચીફ ફાયર ઓફિસર તેમજ સક્ષમ સત્તાની સુચના અનુસાર ડીવીઝનલ ફાયર ઓફિસર સાથે રહીને કરવાની રહેશે.

૭. સ્ટેશન ફાયર ઓફિસરને ઉપરી સક્ષમ સત્તા દ્વારા જણાવવામાં આવે તે જગ્યાએ જાહેર સલામતીનાં હિતમાં જરૂર પડે ત્યારે ફાયર પ્રીવેન્શન - પ્રોટેક્શન માટે બંદોબસ્તનાં સ્થળ ઉપર હાજર રહી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે તેમજ ઉપરી અધિકારીની સુચના અનુસાર જરૂરી અમલ કરવાનો રહેશે.
૮. સ્ટેશન ફાયર ઓફિસરે સ્ટેશન લેવલની તમામ પ્રકારની ફરિયાદોની જાણ જરૂરીયાત મુજબ લેખિતમાં કે મૌખિકમાં પોતાનાં ઉપરી ડીવીઝનલ ફાયર ઓફિસરને કરવાની રહેશે, અને જે તે ફરિયાદનો નિકાલ પોતાનાં ઉપરી અધિકારી કે સક્ષમ સત્તાની સુચના અનુસાર કરાવવાનો રહેશે.
૯. સ્ટેશન ફાયર ઓફિસરે સ્ટેશન લેવલે પોતાની હાથ નીચે ફરજ બજાવતા નીચેનાં તમામ હોદાનાં કર્મચારીઓની પોતાની ફરજ પ્રત્યે કે અન્ય અધિકારી - કર્મચારી સાથેની ફરજ પ્રત્યેની બેદરકારી, ગેરશિસ્ત, ગેરવતાર્દુક અથવા ફરજ દરમ્યાન અનિયમિત્તા જણાય તો જે તે સંબંધિત કર્મચારીને ખુનિસિપલ કોર્પોરેશનના નીતી - નિયમ અનુસાર પોતાની સત્તા મર્યાદામાં રહી જરૂરી જાવક આપી જરૂરી ખુલાસો માંગવાની કાર્યવાહી તેમજ જરૂર પડે તે સંજોગોમાં જે તે નીચેનાં હોદાનાં સંબંધિત કર્મચારીને પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી કે ગેરશિસ્ત બદલ જરૂરી લેખીત કે મૌખિકમાં તાકીદ આપવાની કાર્યવાહી તેમજ શિક્ષાત્મક પગલા રૂપે સત્તા મર્યાદામાં જરૂરી ગાઈ ડ્યુટી આપવાની કાર્યવાહી કરવાની રહેશે અને કરેલ કાર્યવાહીની જાણ પોતાનાં ઉપરી ડીવીઝનલ ફાયર ઓફિસરને કરવાની રહેશે.
૧૦. દરેક સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં ફાયર સ્ટેશનની ફૈનિક મહત્વની કામગીરી અને ઘટનાનો (ખેરીયત) રીપોર્ટ રોજ રોજ કન્ટ્રોલ રૂમને તેમજ પોતાનાં ડીવીઝનલ ફાયર ઓફિસરને કરવાનો રહેશે.
૧૧. સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં સ્ટેશન લેવલનાં ખાતાકીય વહીવટ માટે તૈયાર કરવામાં આવતા અકરન્સબુક, ડ્યુટીબુક, ડેઇલી ડ્યુટી રજસ્ટર, હાજરી પત્રક, ડેડ સ્ટોક રજસ્ટર, બંદોબસ્ત રજસ્ટર તેમજ જરૂરી તમામ રજસ્ટરો, દસ્તાવેજો તૈયાર કરવા અથવા પોતાના હાથ નીચેના સંબંધિત કર્મચારી પાસે નિયમિત ધોરણો સમય મર્યાદામાં તૈયાર કરાવી ખાતાકીય તમામ રજસ્ટરો, દસ્તાવેજોને નિયમિત ધોરણે ઉપરી અધિકારીની સુચના અનુસાર નોંધ માટે મુકવાનાં રહેશે.
૧૨. સ્ટેશન ફાયર ઓફિસરે સ્ટેશન લેવલનાં જરૂરી સાધનો - વાહનોને જરૂરીયાત મુજબ કાર્યરત (વર્કિંગ ઓર્ડરમાં) રાખવા માટે જરૂરી તમામ કાર્યવાહી તેમજ સ્ટેશન ખાતે જરૂરીયાત મુજબની સ્ટેશનરી મેળવવાની કાર્યવાહી, સ્ટેશન ખાતે રાખવામાં આવેલ અન્ય સાધનો તથા સ્ટાફ કવાર્ટ્સનાં જરૂરી મેઈનન્ટેનાન્સ માટેની કાર્યવાહી ડીવીઝનલ ફાયર ઓફિસર મારફતે કરવાની રહેશે.
૧૩. સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં સ્ટેશન લેવલનાં હાથ નીચેનાં હોદાનાં તમામ કર્મચારીઓની પોતાની સત્તા મર્યાદામાં રહીને, શોર્ટલીવ (ટુકી રજા) ઉપરાંત કેઝ્યુઅલ રજા, હક્ક રજા, માંદગીની રજા, જાહેર તહેવારની રજા નિતિ નિયમ અનુસાર મંજૂર કરવાની રહેશે. આ રજાઓ મંજૂર કરતી વખતે ખાતાકીય કામગીરી ઝડપી અને સરળતાથી કરી શકાય તે માટે જરૂરી સ્ટાફની હાજરીને ધ્યાનમાં રાખી ખાતાકીય સગવડતા મુજબ રજા મંજૂર કરવાની રહેશે.
૧૪. સ્ટેશન ફાયર ઓફિસરે તમામ પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ ડ્રીલમાં હાજર રહી પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ ડ્રીલને લગતી તમામ કાર્યવાહી હાથ નીચેનાં કર્મચારીઓ પાસે કરાવવાની અને શીખવાડવાની રહેશે.

૧૫. ફાયર સ્ટેશન ઉપર રાખવામાં આવેલ હાઈડ્રોલીક પ્લેટફોર્મ, કેઈન, ઈમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, ડી.સી.પી. ટેન્ડર, ફોમ ટેન્ડર, બી.એ. વાન તેમજ અન્ય વાહનો અને કિમંતી અને નાજુક તમામ સાધનોનો ઉપયોગ, મેઇન્ટેનન્સ, રીપેરીંગ તથા અન્ય કાર્યવાહી સ્ટેશન ફાયર ઓફિસરે પોતાની સીધી દેખરેખ હેઠળ કરવાની રહેશે. અને જરૂર પડે થી પોતાનાં ડીવીઝનલ ફાયર ઓફિસરનું માર્ગદર્શન મેળવી તે મુજબની કામગીરી કરવાની રહેશે.
૧૬. સ્ટેશન ફાયર ઓફિસરે ટુકી રજાઓ ઉપર જવા માટે પોતાની ઉપરી સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ પોતાનું સ્ટેશન છોડવાનું રહેશે, ટુકી રજા ઉપર ગયેલ સ્ટેશન ફાયર ઓફિસર પોતાનાં હેડ કવાટર વિસ્તાર છોડી શકશે નહીં, અને સ્ટેશન ફાયર ઓફિસરે સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ જે તે પ્રકારની રજા ઉપર છૂટા થવાનું રહેશે. અને તે બાબતની મંજૂરી મળેથી હેડ કવાટર ખાતે કંન્ટ્રોલર્સમને તે બાબતની જાણ કર્યા બાદ જ રજા ઉપર છૂટા થવાનું રહેશે.
૧૭. દરેક સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં સ્ટેશન લેવલનાં આગ - અક્સમાતનાં તેમજ અન્ય ઈમરજન્સી બનાવો તેમજ અન્ય કામગીરીનો માસીક - ત્રિમાસીક - છ માસીક અને વાર્ષિક અહેવાલ સમય મર્યાદામાં તૈયાર કરી ડીવીઝનલ ફાયર ઓફિસરને રજુ કરવાનો રહેશે.
૧૮. સ્ટેશન ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ હસ્તકનાં ટ્રેનિંગ સેન્ટરમાં ખાતાનાં કર્મચારીઓ તેમજ અન્ય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ માટે, તમામ પ્રકારનાં ઓફ્ફિશિયલ એકમોનાં કર્મચારીઓ માટે, શાળા - કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે તથા અન્ય જરૂરી તમામ સંસ્થાઓનાં કર્મચારીઓ કે રહીશો માટે ફાયર એન્ડ સેફ્ટીને લગતા અવેરનેશ પ્રોગ્રામ તેમજ ફાયર એન્ડ રેસ્ક્યુની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપી તેમજ ખાતાનાં કર્મચારીઓ માટે પરેડનો માસિક કાર્યક્રમ તૈયાર કરી તેનો અમલ કરી કરાવીને તેની જરૂરી નોંધ ડીવીઝનલ ફાયર ઓફિસર મારફત ઉપરી સક્ષમ સત્તા સમક્ષ મુકવાની રહેશે.
૧૯. તમામ સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં ઉપરી અધિકારી તેમજ સક્ષમ સત્તા દ્વારા જે ખાતાકીય ફરજ સોંપવામાં આવે તે ફરજ બજાવવાની રહેશે.

સબ ફાયર ઓફિસર :-

સબ ફાયર ઓફિસરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં તેઓનું જે ફાયર સ્ટેશન ઉપર પોસ્ટીંગ કરવામાં આવેલ હોય અથવા તેઓની જે ફાયર સ્ટેશન ઉપર જયારે બદલી કરવામાં ત્યારે તે ફાયર સ્ટેશનનાં સ્ટેશન ફાયર ઓફિસરની સીધી દેખરેખ હેઠળ ખાતાકીય જે ફરજો સોંપવામાં આવે તે બજાવવાની રહેશે. સ્ટેશન ફાયર ઓફિસરની અન ઉપસ્થિતિમાં સ્ટેશન લેવલનાં સંપૂર્ણ ચાર્જની જવાબદારી સંભાળવાની રહેશે. તદ ઉપરાંત પોતાનાં ઉપરી અધિકારી કે અન્ય સક્ષમ સત્તા દ્વારા જે આદેશ આપવામાં આવે તે પ્રમાણેની ખાતાકીય ફરજ બજાવવાની રહેશે.

૧. સબ ફાયર ઓફિસરે ખૂનિ. ક્રોપો. દ્વારા નિયત કરેલ યુનિફોર્મ ઓફિસ તેમજ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે અને નિયમિત હેરકટીંગ અને કલીન શેવીંગ સાથેના સ્માર્ટ ટર્નઆઉટમાં ફરજ

ઉપર આવવાનું રહેશે, તેમજ પોતાનાં હાથ નીચેના કર્મચારીઓ પાસે સંદર બાબતનું પાલન નિયમીત પણે કરાવવાનું રહેશે.

૨. સબ ફાયર ઓફિસરે ફાયર સ્ટેશન ઉપર હાજર હોય ત્યારે હાથ નીચેના કર્મચારીઓની દૈનિક હાજરી લેવા માટે તેમજ રોજેરોજનાં વર્કિંગ / મેઈનન્ટેનન્સનાં સમયમાં પોતાનાં હાથ નીચેના કર્મચારીઓ પાસેથી જરૂરી કામગીરી કરાવવા માટેનું આયોજન કરવાનું રહેશે, તથા હાથ નીચેના કર્મચારીઓ પોતાની ફરજનું પાલન સુવ્યવસ્થિત રીતે શિસ્તબધ્ય રીતે કરે છે કે નહી તે અંગેની જરૂરી નોંધ પણ રાખવાની રહેશે, અને તે અંગેની લેખિત જાણ પોતાનાં ઉપરી અધિકારીને કરવાની રહેશે.
૩. સબ ફાયર ઓફિસરે પોતાનાં ફાયર સ્ટેશન ઉપર આવતા તમામ ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઇમરજન્સીનાં બનાવો દરમ્યાન સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી, જરૂરી બચાવ કામગીરી કરવા ઉપરાંત, હાથ નીચેના કર્મચારીઓને સફળતા પૂર્વકની કામગીરી કરાવવાની રહેશે.
૪. દરેક સબ ફાયર ઓફિસરે પોતાનાં ફાયર સ્ટેશનના ફાયર અને રેસ્ક્યુનાં બનાવોમાં તથા અન્ય ઇમરજન્સીનાં બનાવોમાં તેમજ સ્ટેશન લેવલનું વહીવટી સંચાલન કરવાનું તથા અન્ય મહત્વની કાર્યવાહીની નોંધની જાણ તેઓનાં સ્ટેશન ફાયર ઓફિસર મારફતે ડીવીઝનનાં ડીવીઝનલ ફાયર ઓફિસરને કરવાની રહેશે.
૫. સબ ફાયર ઓફિસરે પોતાનાં ફાયર સ્ટેશનની, ફાયર અને રેસ્ક્યુની ઓપરેશનલ ફરજો ઉપરાંત, પોતાનાં સ્ટેશન લેવલની કામગીરીને લગતી તમામ બાબતોનો આતંરીક પત્ર વ્યવહાર (ઇન્ટરનલ રીપોર્ટિંગ) પોતાનાં ઉપરી સ્ટેશન ફાયર ઓફિસર તથા ડીવીઝનલ ફાયર ઓફિસર મારફતે સક્ષમ સત્તા સાથે કરવાનો રહેશે.
૬. સબ ફાયર ઓફિસરને ઉપરી સક્ષમ સત્તા દ્વારા જણાવવામાં આવે તે જગ્યાએ જાહેર સલામતીનાં હિતમાં જરૂર પડે ત્યારે ફાયર પ્રીવેન્શન - પ્રોટેક્શન માટે બંદોબસ્તનાં સ્થળ ઉપર હાજર રહી જરૂરી કાર્યવાહી કરવાની તેમજ ઉપરી અધિકારીની સુચના અનુસાર જરૂરી અમલ કરવાનો રહેશે.
૭. સબ ફાયર ઓફિસરે સ્ટેશન લેવલની તમામ પ્રકારની ફરિયાદોની જાણ જરૂરીયાત મુજબ લેખિતમાં કે મૌખિકમાં પોતાનાં ઉપરી સ્ટેશન ફાયર ઓફિસર મારફતે ડીવીઝનલ ફાયર ઓફિસરને કરવાની રહેશે, અને જે તે ફરિયાદનો નિકાલ પોતાનાં ઉપરી અધિકારી કે સક્ષમ સત્તાની સુચના અનુસાર કરાવવાનો રહેશે.
૮. સબ ફાયર ઓફિસરે સ્ટેશન લેવલે પોતાની હાથ નીચે ફરજ બજાવતા નીચેનાં તમામ હોદાનાં કર્મચારીઓ પોતાની ફરજ પ્રયે કે અન્ય અધિકારી - કર્મચારી સાથેની ફરજ પ્રયેની બેદરકારી, ગેરશિસ્ત, ગેરવતાર્થુક અથવા ફરજ દરમ્યાન અનિયમિતા જણાય તો જે તે સંબંધિત કર્મચારીએ કરેલ હક્કીતનો લેખિત રીપોર્ટ પોતાનાં ઉપરી સ્ટેશન ફાયર ઓફિસર મારફતે ડીવીઝનલ ફાયર ઓફિસરને કરવાનો રહેશે. અને જરૂર જણાય તો તે અંગેની જાણ સક્ષમ સત્તાને કરવાની રહેશે.
૯. દરેક સબ ફાયર ઓફિસરે પોતાનાં ફાયર સ્ટેશનની દૈનિક મહત્વની કામગીરી અને અન્ય બાબતોનો, બંધ વાહનોની દૈનિક નોંધ, ગેર હાજર કર્મચારીઓની વિગતવાર યાદી (બેરીયત રીપોર્ટ) રોજે રોજ કન્ટ્રોલ રૂમને તેમજ પોતાનાં ઉપરી સ્ટેશન ફાયર ઓફિસર મારફતે ડીવીઝનલ ફાયર ઓફિસરને કરવાનો રહેશે.

૧૦. સબ ફાયર ઓફિસરે પોતાનાં સ્ટેશન લેવલનાં ખાતાકીય વહીવટ માટે તૈયાર કરવામાં આવતા અકરન્સબુક, ડયુટીબુક, ટેઈલી ડયુટી રજીસ્ટર, હાજરી પત્રક, ટેડ સ્ટોક રજીસ્ટર, બંદોબસ્ત રજીસ્ટર તેમજ જરૂરી તમામ રજીસ્ટરો, દસ્તાવેજો તૈયાર કરવા અથવા પોતાના હાથ નીચેના સંબંધિત કર્મચારી પાસે નિયમિત ધોરણે સમય મર્યાદામાં તૈયાર કરાવી ખાતાકીય તમામ રજીસ્ટરો, દસ્તાવેજોને નિયમિત ધોરણે ઉપરી સ્ટેશન ફાયર ઓફિસર અને ડીવીઝનલ ફાયર ઓફિસર મારફતે સક્ષમ સત્તાની નોંધ માટે મુકવાનાં રહેશે.
૧૧. સબ ફાયર ઓફિસરે સ્ટેશન લેવલનાં જરૂરી સાધનો - વાહનોને જરૂરીયાત મુજબ કાર્યરત (વર્કિંગ ઓર્ડરમાં) રાખવા અથવા રીપેરીંગ કરવા માટે જરૂરી તમામ લેખિત કાર્યવાહી તેમજ સ્ટેશન ખાતે જરૂરીયાત મુજબની સ્ટેશનરી મેળવવાની લેખિત કાર્યવાહી, સ્ટેશન ખાતે રાખવામાં આવેલ અન્ય સાધનો તથા સ્ટાફ કવાર્ટસનાં જરૂરી મેઇનન્ટેનાન્સ માટેની લેખિત કાર્યવાહી સ્ટેશન ફાયર ઓફિસર અને ડીવીઝનલ ફાયર ઓફિસર મારફતે કરવાની રહેશે, તેમજ દરેક વાહનોની લોગ બુક તથા વાહનને સલાગ અન્ય રજીસ્ટરમાં વાહનનાં વપરાશ અંગેની જરૂરી નોંધ જે તે ફ્રાયવર પાસે કરાવી તે એન્ટ્રીઓનું ચેકિંગ કરવાનું રહેશે.
૧૨. સબ ફાયર ઓફિસરે પોતાનાં સ્ટેશન લેવલનાં હાથ નીચેનાં હોદાનાં તમામ કર્મચારીઓની પોતાની સત્તા મર્યાદામાં રહીને, શોર્ટલીવ (ટુંકી રજા) નિતિ નિયમ અનુસાર મંજૂર કરવાની રહેશે. આ રજાઓ મંજૂર કરતી વખતે ખાતાકીય કામગીરી ઝડપી અને સરળતાથી કરી શકાય તે માટે જરૂરી સ્ટાફની હાજરીને ધ્યાનમાં રાખી ખાતાકીય સગવડતા મુજબ રજા મંજૂર કરવાની રહેશે.
૧૩. સબ ફાયર ઓફિસરે તમામ પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ શ્રીલમાં હાજર રહી પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ શ્રીલને લગતી તમામ કાર્યવાહી કરવાની તથા હાથ નીચેનાં કર્મચારીઓ પાસે કરાવવાની અને શીખવાડવાની રહેશે.
૧૪. ફાયર સ્ટેશન ઉપર રાખવામાં આવેલ હાઈડ્રોલીક પ્લેટફોર્મ, કેઈન, ઈમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, ડી.સી.પી. ટેન્ડર, ફોમ ટેન્ડર, બી.એ. વાન તેમજ અન્ય વાહનો અને કિમંતી અને નાજુક તમામ સાધનોનો ઉપયોગ, મેઇનન્ટેનાન્સ, રીપેરીંગ તથા અન્ય કાર્યવાહી સબ ફાયર ઓફિસરે સ્ટેશન ફાયર ઓફિસરની સુચના મુજબ તમામ કામગીરી કરવા ઉપરાંત હાથ નીચેનાં કર્મચારી પાસે કરાવવાની રહેશે. અને જરૂર પડે થી પોતાનાં ડીવીઝનલ ફાયર ઓફિસરનું માર્ગદર્શન મેળવી તે મુજબની કામગીરી કરવાની રહેશે.
૧૫. સબ ફાયર ઓફિસરે ટુકી રજાઓ ઉપર જવા માટે પોતાની ઉપરી સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ પોતાનું સ્ટેશન છોડવાનું રહેશે, ટુકી રજા ઉપર ગયેલ સબ ઓફિસર પોતાનાં હેડ કવાટર વિસ્તાર છોડી શકશે નહીં, અને સબ ફાયર ઓફિસરે સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ જે તે પ્રકારની રજા (કેજ્યુલ - હક્ક - માંદગીકની રજા) ઉપર છૂટા થવાનું રહેશે. અને તે બાબતની મંજૂરી મળેથી હેડ કવાટર ખાતે કન્ટ્રોલરને તે બાબતની જાણ કર્યા બાદ જ રજા ઉપર છૂટા થવાનું રહેશે.
૧૬. દરેક સબ ફાયર ઓફિસરે પોતાનાં સ્ટેશનનાં આગ - અક્સમાતનાં તેમજ અન્ય ઈમરજન્સી બનાવો તેમજ અન્ય કામગીરીનો માસીક - ત્રિમાસીક - છ માસીક અને વાર્ષિક અહેવાલ પોતાનાં ઉપરી સ્ટેશન ફાયર ઓફિસર અને ડીવીઝનલ ફાયર ઓફિસરની સુચના મુજબ સમય મર્યાદામાં તૈયાર કરી સક્ષમ સત્તા સમક્ષ રજી કરવાનો રહેશે.

૧૭. સબ ફાયર ઓફિસરે પોતાનાં ઉપરી સ્ટેશન ફાયર ઓફિસરની અને ડીવીઝનલ ફાયર ઓફિસરની સુચના અનુસાર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ હસ્તકનાં ટ્રેનિંગ સેન્ટરમાં ખાતાનાં કર્મચારીઓ તેમજ અન્ય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ માટે, તમામ પ્રકારનાં ઓધોગિક એકમોનાં કર્મચારીઓ માટે, શાળા - કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે તથા અન્ય જરૂરી તમામ સંસ્થાઓનાં કર્મચારીઓ કે રહીશો માટે ફાયર એન્ડ સેફ્ટીને લગતા અવેરનેશ પ્રોગ્રામ તેમજ ફાયર એન્ડ રેસ્ક્યુની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપી તેમજ ખાતાનાં કર્મચારીઓ માટે ડૈનિક પરેડનો કાર્યક્રમ તૈયાર કરવાનો રહેશે.
૧૮. તમામ સ્ટેશન ફાયર ઓફિસરે પોતાનાં ઉપરી અધિકારી તેમજ સક્ષમ સત્તા દ્વારા જે ખાતાકીય ફરજ સોંપવામાં આવે તે ફરજ બજાવવાની રહેશે.

ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટર :-

ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટરે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં તેઓનું જે ફાયર સ્ટેશન ઉપર પોસ્ટીંગ કરવામાં આવેલ હોય અથવા તેઓની જે ફાયર સ્ટેશન ઉપર જ્યારે બદલી કરવામાં ત્યારે તે ફાયર સ્ટેશનનાં ઉપરી અધિકારીની સીધી દેખરેખ હેઠળ તેઓનાં આદેશ પ્રમાણે ખાતાકીય જે ફરજો સોંપવામાં આવે તે બજાવવાની રહેશે. તથ ઉપરાંત પોતાનાં ઉપરી અધિકારી કે અન્ય સક્ષમ સત્તા દ્વારા જે આદેશ આપવામાં આવે તે પ્રમાણેની ખાતાકીય ફરજ બજાવવાની રહેશે.

૧. ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટરે ખુનિ. કોર્પો. દ્વારા નિયત કરેલ યુનિફોમ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે અને નિયમિત હેરકટીંગ અને કલીન શેવીંગ સાથેના સ્માર્ટ ટર્નઆઉટમાં ફરજ ઉપર આવવાનું રહેશે.
૨. ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટરે સ્ટેશન લેવલની ડૈનિક હાજરીમાં, વાહનો - સાધનોનાં વર્કિંગ મેઈનન્ટેનન્સ તેમજ જરૂર પડે ઉપરી અધિકારી દ્વારા જ્યારે બોલાવવામાં આવે ત્યારે ફરજ ઉપર હાજર થવાનું રહેશે.
૩. ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટરે પોતાનાં ફાયર સ્ટેશન ઉપર આવતા તમામ ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવો દરમ્યાન તેઓને સોંપવામાં આવેલ જે તે વાહન સાથે સ્થળ ઉપર ઢુબરુ હાજર રહી ઉપરી અધિકારી સુચના મુજબ જરૂરી તમામ કામગીરી સફળતા પૂર્વકની કરવાની રહેશે.
૪. ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટરને સોંપવામાં આવેલ જે તે પ્રકારનાં વાહન - સાધનને સંપૂર્ણ પણે વર્કિંગ ઓડરમાં રાખવાની જવાબદારી તેઓની રહેશે, અને જરૂર પડેથી જરૂરી તમામ પ્રકારનું રીપેરીંગ કામ અન્યમાંથી પછી કરાવી લેવા માટે પોતાનાં ઉપરી સબ ઓફિસર અને સ્ટેશન ફાયર ઓફિસર મારફતે જરૂરી લેખિત રીપોર્ટ સક્ષમ સત્તાને કરવાનો રહેશે.
૫. આગનાં કોલમાંથી પરત આવ્યા બાદ તમામ ફાયર ફાઈટીંગ યુનિટોમાં નવેસરથી પાણી ભરાવવાની તેમજ અન્ય સાધનો ઉપયોગીતા મુજબ સુવયવસ્થિત રાખવાની જવાબદારી જે તે ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટરની રહેશે.
૬. ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટરને સોંપવામાં આવેલ જે તે પ્રકારનાં વાહનમાં જરૂરી બળતણ (પેટ્રોલ - ડીઝલ - ઓઈલ - સી.એન.જી. - એલ.પી.જી.) જરૂરીયાત મુજબ રાખવાની તેમજ એન્જિન - રેડીમેટર - પમ્પ - બ્રેક - સ્પેર વ્હીલ - વિવિધ સ્પેનરો (પાના - ઓજારો) - જનરેટર - લાઈટ - ઓઈલ - પાણી

- વિગેરે નિયમિત પણે ટેસ્ટ કરવાની તથા ચકાસણી કરવાની અને જરૂરીયાત મુજબ રાખવાની સંપૂર્ણ જવાબદારી ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરની રહેશે.
૭. ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને સોંપવામાં આવેલ વાહનનો આગળનો વીન્ડશીલ ગ્લાસ તથા અન્ય તમામ ગ્લાસમાંથી સ્પષ્ટ પણે જોઈ શકાય તે રીતે સાફ - ચોખ્ખો રાખવાની તેમજ વાહનનો ઉપયોગ કર્યા બાદ તે સંપૂર્ણ પણે સ્વચ્છ રાખવાની જવાબદારી ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરની રહેશે.
 ૮. ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને સોંપવામાં આવેલ જે તે પ્રકારનું વાહનનો ચાર્જ અન્ય ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને સોંપતી વખતે પોતાનાં ચાર્જનાં સમય સુધીનાં વાહનનાં વપરાશની સંપૂર્ણ પણે નોંધ લોગ બુક તથા જે તે વાહન રજીસ્ટરમાં કરવા ઉપરાંત જે તે વાહન પેટે મેળવેલ સરકારી નાંશા - રસીદ બુક વિગેરે બાબત તથા વાહનમાં રહેલ તમામ પ્રકારનાં સાધન સામગ્રી સાથે તથા તે અંગેની જરૂરી જાણ સાથે જ સામેનાં જે તે ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને પોતાનાં વાહનનો ચાર્જ સોંપવાનો રહેશે.
ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરે ઉપરી અધિકારીનાં આદેશ મુજબ અન્ય વાહનનો ચાર્જ સામેના ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર પાસેથી સંભાળતી વખતે ઉપરોક્ત જાણવેલ તમામ બાબતો ધ્યાનમાં લેવાની રહેશે.
 ૯. ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને સોંપવામાં આવેલ વાહનનો વપરાશ કર્યા બાદ જે તે વાહનની લોગ બુક અને અન્ય રજીસ્ટરમાં તે અંગેની જરૂરી તમામ નોંધ અને બળતણ અંગેનો હિસાબ નિયમિત પણે રાખવાનો રહેશે.
 ૧૦. ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરે તમામ પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ ફ્રીલમાં હાજર રહી પરેડ તથા ફાયર અને રેસ્ક્યુ ફ્રીલને લગતી તમામ કાર્યવાહી પરેડનાં જવાબદાર અધિકારીનાં આદેશ મુજબ કરવાની રહેશે.
 ૧૧. ફાયર સ્ટેશન ઉપર રાખવામાં આવેલ તમામ પ્રકારનાં વાહનો, સાધનોનો ઉપયોગ, મેઇન્ટેનાન્સ, રીપેરીંગ તથા અન્ય કાર્યવાહી, ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર સબ ફાયર ઓફિસર અને સ્ટેશન ફાયર ઓફિસરની સુચના મુજબ તમામ કામગીરી કરાવવાની રહેશે.
 ૧૨. ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરે ટુકી રજાઓ ઉપર જવા માટે પોતાની ઉપરી સક્ષમ સત્તાની પૂર્વ મંજુરી મેળવીને જ પોતાનું સ્ટેશન છોડવાનું રહેશે, ટુકી રજા ઉપર ગયેલ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર પોતાનાં હેડ કવાટર વિસ્તાર છોડી શકશે નહીં, અને ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર સક્ષમ સત્તાની પૂર્વ મંજુરી મેળવીને જ જે તે પ્રકારની રજા (કેજ્યુલ - હક્ક - માંદગીકની રજા) ઉપર છૂટા થવાનું રહેશે. અને તે બાબતની મંજુરી મળેથી હેડ કવાટર ખાતે કંન્ટ્રોલરુમને તે બાબતની જાણ કર્યા બાદ જ રજા ઉપર છૂટા થવાનું રહેશે.
 ૧૩. તમામ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરે પોતાનાં ઉપરી અધિકારી તેમજ સક્ષમ સત્તા દ્વારા જે ખાતાકીય ફરજ સોંપવામાં આવે તે ફરજ બજાવવાની રહેશે.

ફાયરમેન :-

ફાયર મેને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં તેઓનું જે ફાયર સ્ટેશન ઉપર પોસ્ટીંગ કરવામાં આવેલ હોય અથવા તેઓની જે ફાયર સ્ટેશન ઉપર જ્યારે બદલી કરવામાં ત્યારે તે ફાયર સ્ટેશનનાં ઉપરી અધિકારીની સીધી દેખરેખ હેઠળ તેઓનાં આદેશ પ્રમાણે ખાતાકીય જે ફરજે સોંપવામાં આવે તે બજાવવાની રહેશે. તદ ઉપરાંત પોતાનાં ઉપરી અધિકારી કે અન્ય સક્ષમ સત્તા દ્વારા જે આદેશ આપવામાં આવે તે પ્રમાણેની ખાતાકીય ફરજ બજાવવાની રહેશે.

૧. ફાયર મેને યુનિ. કોર્પો. દ્વારા નિયત કરેલ યુનિફોમ જરૂરી તમામ ફરજ દરમ્યાન પહેરવાનો રહેશે અને નિયમિત હેરકટીંગ અને કલીન શેવીંગ સાથેના સ્માર્ટ ટન્નઆઉટમાં ફરજ ઉપર આવવાનું રહેશે.
૨. ફાયર મેને ફાયર સ્ટેશન ઉપર દૈનિક હાજરી તેમજ રોજેરોજનાં વર્કિંગ / મેઈનન્ટેનન્સનાં સમયમાં ફરજયાત પણે પોતાની ફરજનું પાલન શિસ્તબધ્ય પણે કરવું.
૩. ફાયર મેને પોતાનાં ફાયર સ્ટેશન ઉપર આવતા તમામ ફાયર અને રેસ્ક્યુનાં તેમજ અન્ય ઈમરજન્સીનાં બનાવો દરમ્યાન સ્થળ ઉપર રૂબરૂ હાજર રહી, જરૂરી ભચાવ કામગીરી સફળતા પૂર્વક કરવવાની રહેશે.
૪. ફાયર મેને પોતાનાં ફાયર સ્ટેશનનાં, ફાયર અને રેસ્ક્યુની ઓપરેશનલ ફરજો ઉપરાંત, પોતાનાં સ્ટેશન લેવલની કામગીરી કરવી .
૫. ફાયરમેને પોતાનાં ફાયર સ્ટેશન ઉપર ગોઠવણ કરેલ હોય તે પ્રમાણે પહેરા ડ્યુટી, ટેલીફોન ડ્યુટી, દૈનિક પરેડ તેમજ ઉપરી અધિકારીનાં આદેશ મુજબ ખાતાકીય અને અન્ય ફરજો બજાવવાની રહેશે.
૬. ફાયરમેનનાં પહેરા ડ્યુટી, ટેલીફોન ડ્યુટી જેવી ફરજો તેમજ આગ - અક્સમાતનાં કોલમાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝથી જે યુનિફોમ ફાળવવામાં આવેલ છે તે ફરજયાત પણે પહેરવાનો રહેશે.
૭. ફાયરમેનનાં પહેરા ડ્યુટી, ટેલીફોન ડ્યુટી દરમ્યાન પોતાનાં સ્ટેશનનું વાહન ફાયર સ્ટેશન છોડી બહાર જાય તો તેની નોંધ અકરન્સબુક અથવા ડ્યુટીબુક રજસ્ટરમાં કરવાની રહેશે, તેમજ પોતાનાં સ્ટેશનનાં જવાબદાર લીડિંગ ફાયર મેન, સબ ઓફિસર અને કન્ટ્રોલ રૂમને અવશ્ય જાણ કરવાની રહેશે.
૮. ફાયરમેનની દૈનિક હાજરી તેમજ રોજેરોજનાં વર્કિંગ / મેઈનન્ટેનન્સ દરમ્યાન કોઈ સાધન કે વાહન ખામી ભરેલ માલૂમ થાય અથવા તૂટેલ જણાય તો તેની જાણ પોતાના લીડિંગ ફાયર મેન, સબ ઓફિસર અને કન્ટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે.
૯. ફાયર મેને ટુકી રજાઓ ઉપર જવા માટે પોતાની ઉપરી સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ પોતાનું સ્ટેશન છોડવાનું રહેશે, ટુકી રજા ઉપર ગયેલ ફાયર મેન પોતાનાં હેડ કવાટર વિસ્તાર છોડી શકશે નહીં, અને ફાયર મેન સક્ષમ સત્તાની પૂર્વ મંજૂરી મેળવીને જ જે તે પ્રકારની રજા (કેજ્યુલ - હક્ક - માંદગીકની રજા) ઉપર છૂટા થવાનું રહેશે. અને તે બાબતની મંજૂરી મળેથી હેડ કવાટર ખાતે કન્ટ્રોલરૂમને તે બાબતની જાણ કર્યી બાદ જ રજા ઉપર છૂટા થવાનું રહેશે.
૧૧. તમામ ફાયર મેને પોતાનાં ઉપરી અધિકારી તેમજ સક્ષમ સત્તા દ્વારા જે ખાતાકીય ફરજ સોંપવામાં આવે તે ફરજ બજાવવાની રહેશે.

પ્રકરણ-૫

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

શાયરખાતાના માળખાની માહીતી

ડે.ભ્યુનિસિપલ કમિશનર



ચીફ શાયર ઓફિસર



એડી.ચીફ શાયર ઓફિસર



ડે.ચીફ શાયર ઓફિસ



ડિવીઝનલ શાયર ઓફિસર



સ્ટેશન ઓફિસર



સબ શાયર ઓફિસર



હેડ ડ્રાયવર



જમાદાર



ડ્રાયવર કમ પંપ ઓપરેટર



શાયરમેન



સ્ટ્રોચર બેરર



સફાઈ કામદાર

કોમ્પ્યુ.ઓફિસર



વાયરલેસ/ટેલીફોન ઓપરેટર



વાયરલેસ વર્કશોપ



ઓટો વર્કશોપ



આસી.મેનેજર



ઓફિસ સુપ્રિટેન્ડન્ટ



હેડ કલાર્ક



સીની.કલાર્ક



જુની.કલાર્ક



પટાવાળા

પ્રકરણ- ૪ અને ૫

કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો તથા કાર્યો બજાવવા માટેના
નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહ, દફતરો

- બી.પી.એમ.સી.એક્ટ
અમદાવાદ મહાનગર પાલિકા
અમદાવાદ.

પ્રકરણ-૬

સંગઠનના નિયંત્રણ હેઠળની વ્યક્તિત્વો પાસેના દસ્તાવેજોના વર્ગોનું પત્રક

- અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન દ્વારા વખતોવખત અમલમાં આવતા નીતિ નિયમ અનુસાર દસ્તાવેજો જાળવવામાં આવે છે.

પ્રકરણ-૭

નીતિ ધડતર અથવા નીતિ અમલ સંબંધમાં જનતાના સત્યો સાથે પરામર્શ.

- માનનીય ભૂનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, ધારાસત્યશ્રીઓ તેમજ સંસદ સત્યોશ્રીઓના બજટેમાંથી ગ્રાંટ ફાળવવામાં આવે છે.

પ્રકરણ-૮

વ્યવસ્થા તંત્રના ભાગ તરીકે અથવા સલાહના હેતુ માટે બે કે તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ કે સમિતિની નોંધ બાબત.

- સ્ટેન્ડીંગ કમિટી
અમદાવાદ મહાનગર પાલિકા
અમદાવાદ.
- ભૂનિસિપલ બોર્ડ
અમદાવાદ મહાનગર પાલિકા
અમદાવાદ.

પ્રકરણ- ૮ અને ૧૦

અધિકારી અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા અને તેમને વિનિયમોમાં જોગવાઈ કર્યા
પ્રમાણે મળતું માસિક વળતર

ફાયર એન્ડ ઈમજન્સી સવિસીસ ખાતાના ટેકનીકલ અધિકારી તથા કર્મચારી સ્ટાફની યાદી

અ.નં.	હોટો	શીડયુલ પોસ્ટ	ભરાયેલ શીડયુલ	ખાતી શીડયુલ
૧	ચીફ ફાયર ઓફિસર	૧	૧	૦
૨	એડી.ચીફ ફાયર ઓફિસર	૧	૧	૦
૩	ડી.ચીફ ફાયર ઓફિસર	૪	૧	૩
૪	ડીવી. ફાયર ઓફિસર	૪	૨	૨
૫	સ્ટેશન ફાયર ઓફિસર	૧૮	૦	૧૮
૬	સબ ઓફિસર	૨૧	૦	૨૧
૭	હેડ ફાયર	૦	૦	૦
૮	ફાયર કમ પંપ ઓપરેટર	૧૫૮	૬૫	૬૪
૯	જમાદાર (ટીનેલ)	૫૪	૨	૫૨
૧૦	ફાયરમેન	૪૦૮	૧૪૧	૨૬૭
૧૧	સ્ટ્રેચર બેરર, હેડબોડીવાન માટે	૧૮	૧૨	૬
૧૨	સફાઈ કામદાર	૬	૬	૦
૧૩	પાટે ટાઇમ સ્વીપર	૨	૦	૨
૧૪	ફોરમેન	૧	૦	૧
૧૫	હેડ મીકેનિક	૧	૦	૧
૧૬	મીકેનિક	૫	૦	૫
૧૭	ઇલેક્ટ્રીશીયન વકેશોપ	૨	૦	૨
૧૮	ઓટો ઇલેક્ટ્રીશીયન	૦	૦	૦
૧૯	વેલ્ડર	૧	૦	૧
૨૦	કાપૈન્ટર	૧	૧	૦
૨૧	લુહાર	૧	૧	૦
૨૨	સ્ટોર કિપર વકેશોપ	૧	૧	૦
૨૩	હેલ્પર	૧૦	૧૦	૦
૨૪	કલીનર	૧	૧	૦
૨૫	સહાયક ફાયર	૨૨	૧૫	૭
૨૬	સહાયક ફાયરમેન	૭૨	૬૮	૩

એડમીનિસ્ટ્રેટીવ સ્ટાફની યાદી

અ.નં.	હોદ્દો	શીડયુલ પોસ્ટ	ભરાયેલ શીડયુલ	ખાલી શીડયુલ
૧	આસી. મેનજર	૧	૧	૦
૨	ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ	૧	૦	૧
૩	હેડ કલાકે	૧	૧	૦
૪	સીની. કલાકે	૩	૦	૩
૫	જુની. કલાકે	૫	૪	૧
૬	ટાઈપિસ્ટ	૧	૦	૧
૭	પટાવાળા	૧	૧	૦

કોમ્પ્યુનિકેશન સ્ટાફની યાદી

અ.નં.	હોદ્દો	શીડયુલ પોસ્ટ	ભરાયેલ શીડયુલ	ખાલી શીડયુલ
૧	કોમ્પ્યુનિકેશન ઓફિસર	૧	૦	૧
૨	આસી. વાયરલેસ ઓફિસર	૧	૦	૧
૩	રેટીયો મીડિયા	૪	૩	૧
૪	વાયરલેસ ઈલેક્ટ્રોશીયન	૨	૧	૧
૫	ટેલીઝીન વાયરલેસ ઓપરેટર	૨૨	૦	૨૨
૬	વાયરલેસ હેલ્પર	૪	૩	૧

NO	DESIGNATION		GRADE	GRADE-PAY
1	CHIEF OFFICER(FIRE)		15600-39100	7600
2	ADD.CHIEF OFFICER(FIRE)		15600-39100	6600
3	DY. CHIEF OFFICER(FIRE)		9300-34800	5400
4	DIVISIONAL OFFICER(FIRE)		9300-34800	4200
5	STATION OFFICER		9300-34800	4200
6	SUB OFFICER		5200-20200	1900
7	TINDEL(JAMADAR)		5200-20200	1900
8	DRIVER CUM PUMP OPERATOR		5200-20200	2400
9	SAHAYAK DRIVER		FIX PAY	
10	FIREMAN		4440-7440	1650
11	SAHAYAK FIREMAN		FIX PAY	
12	STREATCHER BEARER		4440-7440	1650
13	FOREMAN		9300-34800	4200
14	HEAD MECHANIC		5200-20200	2400
15	MECHANIC		5200-20200	1900
16	WELDER		5200-20200	1900
17	ELECTRICIAN		5200-20200	1900
18	SUTHAR		5200-20200	1900
19	MOCHI		4440-7440	1650
20	CLEANER		4440-7440	1400
21	AUTO ELECTRICIAN		5200-20200	1900
22	LUHAR		5200-20200	1900
23	STOCK KEEPER		9300-34800	4200
24	HELPER		4440-7440	1300
			GRADE	GRADE-PAY
1	COMMUNICATION OFFICER		9300-34800	4200
2	ASST. WIRELSS OFFICER			
3	RADIO MECHANIC		5200-20200	2400
4	WIRELESS ELECTRICIAN		5200-20200	1900
			GRADE	GRADE-PAY
1	ASST. MANAGER		15600-39100	5400
2	OFFICE SUPRINTENDENT		9300-34800	4600
3	HEAD CLERK		9300-34800	4200
4	SR.CLERK		5200-20200	2400
5	TYPIST CUM CLERK		5200-20200	2400
6	JR.CLERK		5200-20200	1900
7	PEON		4440-7440	1300
8	JR.COMPUTER OPERATOR		5200-20200	1900

પ્રકરણ-૧૧

ફાળવેલ અંદાજ પત્રની માહીતી

કેપીટલખર્ચ -૩૦૧

(રૂપિયા લાખમાં)

અનુંનં	એકાઉન્ટ કોડ	એકાઉન્ટ હેડ	મંજુર કરેલ અંદાજ સને. ૨૦૧૫-૧૬
૧	૬૪૨૨૫	ફાયર બ્રિગેડ સ્ટેશન	૧૭૮૫.૨૫
૨	૬૪૭૦૩	અગ્નિ શામક સાધનો	૨૫૦.૦૦
૩	૬૪૭૦૭	સંદેશા વ્યવહારના સાધનો	૩૦.૦૦
૪	૬૪૮૦૩	બસ, એમ્બ્યુલન્સ તથા શબ વાહિની	૭૫.૦૦

રેવન્યુ ખર્ચ -૩૦૧

(રૂપિયા લાખમાં)

અનુંનં	એકાઉન્ટ કોડ	એકાઉન્ટ હેડ	મંજુર કરેલ અંદાજ સને. ૨૦૧૫-૧૬
૧	૩૦૧૬૮	પગારખર્ચ	૧૨૩૩.૭૩
૨	૩૦૪૦૧	યુર્નિઝોમ	૬૦.૦૦
૩	૩૦૪૦૪	એવોર્ડ તથા ઈનામ	૩.૦૦
૪	૩૪૧૦૧	ટેલીફોન તથા ટ્રેક કોલ	૧૦.૦૦
૫	૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૦.૫૦
૬	૩૪૨૦૬	લાયસન્સ ફી	૧૫.૦૦
૭	૩૪૩૬૮	ટેક્સીસ કર	૪.૦૦
૮	૩૪૪૦૧	સ્ટેશનરી	૨.૦૦
૯	૩૪૪૦૨	કોમ્પ્યુટર સ્ટેશનરી	૦.૬૦
૧૦	૩૪૪૦૪	પ્રિન્ટીગ	૩.૦૦
૧૧	૩૪૭૦૧	વાર્ષિક મહોત્સવ, ઉજવણી, તહેવારો	૪.૦૦
૧૨	૩૮૮૬૮	અન્ય ખર્ચ	૩.૦૦
૧૩	૩૮૨૦૭	કોમ્પ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમ	૪૦.૦૦
૧૪	૩૮૨૨૫	ફાયર બ્રિગેડ સ્ટેશન	૧૫.૦૦
૧૫	૩૮૨૨૮	ફાયર બ્રિગેડ કવાર્ટ્સ	૧૬.૦૦
૧૬	૩૮૭૦૩	અગ્નિ શામક સાધનો	૩૦.૦૦
૧૭	૩૮૭૦૭	સંદેશા વ્યવહારના સાધનો, ટેલીફોન, વાયરલેસ	૫.૦૦
૧૮	૩૮૭૦૮	એરકન્ડીશનર, એરકુલર, ઐઝીજરેટર્સ, વોટર કુલર	૦.૫૦
૧૯	૩૮૦૦૧	ટેબલ, ખુરણી, બાકડા, બેચ	૩.૦૦
૨૦	૩૮૦૦૪	પંખા, લાઈટ ફીટીગ	૧.૫૦
૨૧	૪૩૧૦૨	અન્ય વિજળી ખર્ચ	૧૨૫.૦૦
૨૨	૪૩૨૦૧	પેટ્રોલ ડિઝલ	૧૭૫.૦૦
૨૩	૪૮૩૨૬	ફાયર ટ્રેનિંગ સર્વિસ ખર્ચ	૨.૦૦
૨૪	૪૮૪૪૨	સહાયક ફાયર ઈમરજન્સી દળ માટેનો ખર્ચ	૨૭૦.૦૦
૨૫	૫૭૩૦૭	મોટર-અક્સમાત કલેઇમ ખર્ચ	૫૦.૦૦

કોમ્યુનિકેશન ખાતાના ફાળવેલ અંદાજ પત્રની માહીતી

રેવન્યુ ખર્ચ-૩૦૪

(રૂપિયા લાખમાં)

અનુંનં	એકાઉન્ટ કોડ	એકાઉન્ટ હેડ	મંજુર કરેલ અંદાજ સને. ૨૦૧૫-૧૬
૧	૩૦૧૮૮	પગારખર્ચ	૩૭.૪૧
૨	૩૪૨૦૬	લાયસન્સ ફી	૮.૦૦
૩	૩૪૩૦૩	મોટર તથા ટ્રાન્સપોર્ટ ના સાધનનું ભાડુ	૫.૦૦
૪	૩૪૪૦૧	સ્ટેશનરી	૧.૦૦
૫	૩૪૪૦૪	પ્રિન્ટીગ	૧.૦૦
૬	૩૪૪૦૫	ટેરોક્ષ	૦.૧૦
૭	૩૪૮૦૮	પુસ્તકો, અખબાર, સામયિક, રમકડા	૦.૧૦
૮	૩૪૮૮૮	અન્ય ખર્ચ	૧.૦૦
૯	૩૮૭૦૭	સંદેશા વ્યવહારના સાધનો, ટેલીફોન, વાયરલેસ	૮.૦૦
૧૦	૩૮૭૦૮	એરકન્ડીશનર, એરકુલર, ઐફીજરેટરસ, વોટર કુલર	૦.૫૦
૧૧	૩૮૭૭૬	ઓજારો અને સાધનો	૧.૫૦
૧૨	૩૮૦૦૧	ટેબલ, ખુરશી, બાકડા, બેચ	૧.૦૦
૧૩	૩૮૦૦૫	પંખા, લાઈટ ફીટીગ	૧.૦૦
૧૪	૪૩૧૦૨	અન્ય વિજળી ખર્ચ	૨.૫૦

પ્રકરણ-૧૨ અને ૧૩

આર્થિક સહાય બાબત, આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાનીવિગતો.

● એમ્બ્યુલન્સ કારનો દર

પ્રથમ કલાકના અગર તેના ભાગ રૂપે રૂ. ૫૦/- અને ત્યાર પછી દર એક કલાકના અગર તેના ભાગના રૂ. ૩૦/- મ્યુનિ. હદની આઠ કિલોમીટરની અંદરના ઉપયોગમાટે દર કલાક અગર તેના ભાગ રૂપે રૂ. ૭૫/- મ્યુનિ. હદ આઠ કિલોમીટરની બહારના ઉપયોગમાટે દર કિલોમીટરે રૂ. ૮/- (આવવા જવાના)

વેઈટિંગ ચાર્જો

પ્રથમ ૩૦ મિનિટ બાદ કરતાં તે પછીના દરેક ૩૦ મિનિટ અગર તેના ભાગના રૂ. ૫૦/-

● શબ્દ વાહિનીનો દર

મ્યુનિ. હદમાં ઉપયોગમાટે દર કલાક અગર તેના ભાગ માટે રૂ. ૫૦/- મ્યુનિ. હદ બહારના ઉપયોગમાટે દર કિલોમીટરે રૂ. ૮/- (આવવા- જવાના)

વેઈટિંગ ચાર્જો

પ્રથમ ૩૦ મિનીટ બાદ કરતાં ત્યાર પછીના દર ૩૦ મિનીટના અગર તેના ભાગના રૂ. ૫૦/-

એમ્બ્યુલન્સ ફી સવિસ

૧ એમ્બ્યુલન્સ કાર માં ફાયરબિંગોડના કમોચારીઓ માટે ફી સવિસ

પ્રકરણ-૧૪

ઇલેક્ટ્રોનીક સ્વરૂપે માહિતી

- અમદાવાદ મહાનગર સેવા સંદર્ભની વેબસાઈટ :- www.egovamc.com ઉપર માહિતી ઉપલબ્ધ છે.

પ્રકરણ-૧૫

ગ્રંથાલય અને વાંચનાલયની સુવિધાઓની વિગત

- આ વિભાગને લાગુ પડતું નથી.

પ્રકરણ-૧૬

- જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દો, સરનામાં, ફોન નંબર

અ.નં	નામ	હોદ્દો	ઓફિસ ટેલીફોન નંબર	મોબાઈલ નંબર	સરનામાની વિગત
૧	શ્રી મહેરનોશ એફ. દસ્તુર	ચીફ ફાયર ઓફિસર (અપીલ અધિકારીશ્રી)	૨૨૧૪૮૮૬૬	૯૮૨૭૦ ૩૮૭૫૪	દાણાપીઠ ફાયર સ્ટેશન
૨	શ્રી હિરેનભાઈ સી.પટેલ	આસી.મેનેજર (જાહેર માહિતીઅધિકારીશ્રી)	૨૨૧૪૮૮૬૬	૯૮૨૭૦ ૩૮૮૩૩	દાણાપીઠ ફાયર સ્ટેશન

પ્રકરણ-૧૭

માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો

મહાનગરપાલિકાની વેબસાઈટ :- www.egovamc.com ઉપર ઉપલબ્ધ છે.